



કોરોનાના 2.11 લાખ નવા કેસ, 3847 દર્દીનાં મોત

PAGE NO. 16



અમેરિકાના સાન જોસ ખાતે ગોળીબારમાં 8 લોકોના મોત

PAGE NO. 18

FRIDAY, 28 MAY, 2021 Vol. 18, No. 22 Pages 20 Tel: 416-996-7755, E-mail : info@swadesh.news Web : www.swadesh.news

આઈટી નિયમોથી મોટો વિવાદ

નવી દિલ્હી

વોટસએપ દ્વારા ભારતનાં નવા આઈટી નિયમોને દિલ્હી હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યા પછી કેન્દ્ર અને સોશિયલ મીડિયા કંપનીઓ વચ્ચે ખરાબરીની સ્થિતિ આવી ગઈ છે. કેન્દ્ર સરકારે ગુરુવારે તમામ સોશિયલ મીડિયા કંપનીઓને આદેશ આપી દીધા હતા કે, સરકારની ગાડઈલાઈન અનુસરવા મુદ્દે તમારી સ્થિતિ રજૂ કરો નહીંતર સજા માટે તૈયાર રહો. બીજી તરફ ટ્વિટરે ભારતના આઈટી નિયમોને અભિવ્યક્તિની સ્વતંત્રતા ઉપર તરાપ માનવા સમાન ગણાવ્યા હતા. જેથી વિવાદ વધ્યો હતો. આઈટી મંત્રાલયે જણાવ્યું હતું કે, વિશ્વની સૌથી મોટી લોકશાહીને નિયમો વિશે ન શીખવશો. તમારે નિયમોના પાલન કરવા વિશે વિચારવાનું છે. ભારતમાં સદીઓથી લોકોને અભિવ્યક્તિની આઝાદી છે અને તેના માટે કોઈના રક્ષણની જરૂર નથી. અભિવ્યક્તિની આઝાદીના રક્ષણ માટે ટ્વિટરે આગેવાન બનવાની જરૂર નથી. ટ્વિટરે ભારતના નિયમો અંગે આગેવાની કરવાના બદલે અને જુઠાણા ફેલાવવા કે દંભ કરવા કરતા તેના પાલન અંગે વિચારવું જોઈએ.

કંપનીએ તમામ વિગતો સરકારને આપવી પડશે

રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે નવા નિયમો ડિજિટલ સામગ્રીને નિયમિત કરવા તેમજ આચારસંહિતાનું પાલન કરવા માટે ખ્રિસ્તીય ફરિયાદ નિવારણનું માળખું રજૂ કરે છે. આઈટી મંત્રાલયે વહેલામાં વહેલી તકે નિયમોનાં પાલનની જાણકારી આપવા તાકીદ કરી છે. જેમાં કંપનીનું નામ, ડિરેક્ટર, સરનામું, ફોન નંબર, ફરિયાદ નિવારણ અધિકારી, સ્વનિયમન સંસ્થાની વિગતો માગવામાં આવી છે. હાલ ૬૦ ડિજિટલ બ્યૂટ પ્લેટફોર્મો નવા નિયમો હેઠળ સેલ્ફ રેગ્યુલેશન સંસ્થા રચવાનું શરૂ કર્યું છે.

‘યાસ’ વાવાઝોડાથી 1 કરોડને અસર, 4નાં મોત

PAGE NO. 17



ABOWATH REAL ESTATE GROUP
VALUING REAL ESTATE TRANSACTIONS EVERY SINGLE TIME!
RE/MAX
MAAZ ABOWATH BROKER
416 893 4585
More info on PAGE 2 વધુ માહિતી પાનું 2 પર
ABOWATH.COM

નિયમોને નહીં અનુસરે તો પગલા માટે તૈયાર રહેવા ટ્વિટરને સરકારની ચીમકી ટ્વિટર-મોદી સરકાર સામ-સામે

અમે સ્ટાફની સુરક્ષા માટે ચિંતિત, દિલ્હી પોલીસના દરોડા ધમકી સમાન : ટ્વિટર

નવી દિલ્હી : ભારતનાં નવા આઈટી નિયમોનું પાલન કરવા માટે ટ્વિટરે વધુ ૩ મહિનાનો સમય માગ્યો છે. ટ્વિટરે કહ્યું હતું કે અમને અમારા સ્ટાફની સુરક્ષાની ચિંતા છે. દિલ્હી પોલીસ દ્વારા ટ્વિટરની ઓફિસ પર પાડવામાં આવેલા દરોડા ધમકી સમાન છે. સરકારના નિયમો અને પોલીસના દરોડા એ અભિવ્યક્તિની સ્વતંત્રતા સામે ખતરા અને ધમકી સમાન છે. નવા નિયમો હેઠળ વાંધાજનક પોસ્ટ મૂકનાર મૂળ યૂઝર્સની ઓળખ જાહેર કરવાનાં મામલાને ટ્વિટરે વ્યક્તિની પ્રાઈવસીના ભંગ સમાન ગણાવી છે. યૂઝર્સની માહિતી મેળવવાનાં મામલે કંપની ચિંતિત છે. આ પ્રકારનો નિયમ લોકશાહી સિદ્ધાંતો સાથે વિસંગત છે. જોકે, ટ્વિટરે ભારત સરકાર સાથે વાતચીત ચાલુ રાખવાનું જણાવ્યું હતું. ટ્વિટરે કહ્યું કે તે ભારતમાં સર્વિસ ચાલુ રાખવા પ્રતિબદ્ધ છે.

વોટસએપે દિલ્હી હાઈકોર્ટના દ્વારા ખખડાવ્યા

કેન્દ્ર સરકારના નવા આઈટી નિયમોને લઈને સોશિયલ મેસેજિંગ એપ વોટસએપએ દિલ્હી હાઈકોર્ટમાં અપીલ કરી છે. વોટસએપએ કોર્ટમાં અપીલ કરી છે કે નવા ડિજિટલ નિયમો પર રોક લગાવવામાં આવે કેમ કે તે વોટસએપ યૂઝર્સની પ્રાઈવસી વિરૂદ્ધ છે. કોર્ટમાં વોટસએપએ કહ્યું છે કે આ નવો કાયદો બંધારણ વિરૂદ્ધનો છે. વોટસએપ દ્વારા દાખલ અરજીમાં દાવો કરાયો છે કે નવા નિયમો અનુસાર અમારે એવા ફીચર ઉમેરવા પડશે કે જેનાથી વોટસએપમાં મેસેજ કોણે સૌથી પહેલા લખ્યો કે મોકલ્યો તેની જાણકારી મેળવી શકાય. જો અમે આ ફીચરનો ઉમેરો કરીશું તો વોટસએપ યૂઝર્સની પ્રાઈવસી જ ખતમ થઈ જશે. જે ભારતના રાષ્ટ્ર ટુ પ્રાઈવસી કાયદાનો પણ ભંગ થશે. વોટસએપની એન્ડ ટુ એન્ડ એનક્રિપ્શન પોલિસી છે તેનો ભંગ થશે. સરકારે જે નવા નિયમો જાહેર કર્યા છે તે મુજબ સોશિયલ મીડિયા સાઈટે જરૂર પડે તો એ જણાવવાનું રહેશે કે સૌથી પહેલા વોટસએપ પર જે મેસેજ ફરતા હોય તેને કોણે મોકલ્યા. આ નવા નિયમોની સૌથી વધુ અસર વોટસએપ પર જોવા મળી શકે છે. કેમ કે વોટસએપમાં કોણે સૌથી પહેલા મેસેજ લખી મોકલ્યો હશે તે કહેવું મુશ્કેલ હોય છે અને તેને ગુપ્ત પણ રાખવામાં આવે છે.

૨૦૨૫ સુધી એરશિપથી અનેક શહેરો વચ્ચે એર ટ્રાન્સપોર્ટેશન શરૂ થશે



વોશિંગ્ટન

દુનિયાના સૌથી વિશાળ એરશિપ એરલેન્ડર ૧૦ની કોન્સેપ્ટ તસવીરો ઉજાગર થઈ હતી. ઈન્ટરનેટ માધ્યમોમાં ફરી રહેલી આ તસવીરો દ્વારા સામે આવ્યું હતું કે, ૨૦૨૫ સુધીમાં લોકોને બે શહેરો વચ્ચે એર ટ્રાન્સપોર્ટેશન આપવા માટે આ એરશિપનું નિર્માણ કરાઈ રહ્યું છે. આ વિશાળ બલૂન જેવી એરશિપમાં સામાન્ય પ્લેન કરતાં વધારે લોકો સમાઈ શકે તેમ છે. આ ઉપરાંત એરશિપની બારીઓની જગ્યાએ વિન્ડોઝ સ્ક્રીન રાખવામાં આવશે. તે ઉપરાંત તેમાં લોકોના ભોજન માટે અને બેસવા માટે પણ વિવિધ વ્યવસ્થા કરવામાં આવી હશે. આ લક્ઝરિયસ હવાઈ પ્રવાસની કિંમત પ્રતિ વ્યક્તિ ૫૦,૦૦૦ ડોલર સુધી આવી શકે છે.



SUPER VISA INSURANCE
Get Full REFUND if visa is declined
Get partial refund if parents leave early*
*conditions apply.... Ask NOW for a free quote...
Sanjiv Puri
Insurance Broker
Ph.: 416-890-3232
Email: sanjivpuri@rogers.com
StarLife
Insurance & Investments Inc.
www.starlifeinsurance.ca
LIFE INSURANCE | FUNERAL INSURANCE | MORTGAGE INSURANCE | CRITICAL ILLNESS INSURANCE | DISABILITY INSURANCE
SUPER VISA INSURANCE | INSURANCE FOR VISITORS / NEW IMMIGRANTS | RESP | ESTATE PLANNING | RRSP | RETIREMENT PLANNING



Need mortgage financing?
Look no further. Let me make it happen.
RBC Royal Bank
BHAVIN PATEL
Mobile Mortgage Specialist
Royal Bank of Canada
bhavin.patel@rbc.com
mortgage.rbc.com/bhavin.patel Cell: 647-502-8069
Serving Greater Toronto Region Fax: 416-253-9461



છેલ્લા ૪૪ વર્ષથી ટોરાન્ટોની સર્વ પ્રથમ ગુજરાતી ટ્રાવેલ એજન્સી. ૪૪ વર્ષથી ગુજરાતી પ્રજા અને ગુજરાતી ભાષા અમારી સફળતા માટે યજ્ઞભાગી છે. દિલથી આપની અમે ખૂબજ આભાર માનીએ છીએ. સ્વાઈ મુસાફરી ની ટીકીટ માટે અમારા ભાવ ટોરાન્ટોમાં ખૂબજ આકર્ષક છે અજમાવી જુઓ... આપને આનંદ થશે.
Ashok Travels 416-977-9896 અશોક ટ્રાવેલ્સ ૪૧૬ ૯૭૭ ૯૮૯૬
Thank you for your continued support since last 44 years. We are glad to be your family travel agency and we feel proud to serve three generations with most competitive prices and excellent service.
www.ashoktravel.com
Ashok Travels Serving your travel needs in Canada since 1973
TICO # 1486999 238 Gerrard St. East, Suite 100 Toronto, ON M5A 2E8



Residential
New Condos
Investments
Commercial
દુસામાં યાદ રાખરો
Zakir Patel
Broker
Cell: 416-561-7973
Office: 416-287-2222
RE/MAX COMMUNITY
Realty Inc., Brokerage
Independently Owned and Operated
1265, Morningside Ave. #203
Toronto, ON M1B 3V9
Email: patelzakir82@gmail.com



SS & LAWYERS LLP
• REAL ESTATE
• LITIGATION
• WILLS AND ESTATES
• AFFIDAVIT AND POWER OF ATTORNEY
• NOTARIZATION
• FAMILY LAW
• CORPORATION / COMMERCIAL TRANSACTIONS
• FRANCHISE CLOSING
Avni Shah
B.A., JD
Barrister & Solicitor
ashah@sslawyers.ca
Tel : 416-818-4000
Fax : 416-740-4002
1780 ALBION ROAD, UNIT # 8, TORONTO ONTARIO M9V 1C1

કોરોનાનું જોર ધીમું પડ્યું : નવા 1571 કેસ, 29ના મોત

સૌથી વધુ કેસ ઓન્ટેરિયોમાં 1135, જ્યારે સૌથી ઓછા ન્યુબ્રુન્સ્વીકમાં 9 દર્દી મળ્યા

ઓન્ટેરિયો : કેનેડામાં કોરોના વાયરસની ગતિ ધીમે ધીમે મંદ પડી રહી છે. ગુરુવારે સમગ્ર દેશમાં 1571 નાગરિકો વાયરસથી સંક્રમિત થયાની પૃષ્ઠિ થઈ હતી. જ્યારે આ જ દરમિયાન 29 લોકોના મોત કોરોનાને કારણે થયા હતા. ગુરુવારે સાંજની સ્થિતિએ સમગ્ર દેશમાં 1236 દર્દીઓની હાલત અત્યંત નાજૂક હોવાનું જાણવા મળ્યું હતું. કેનેડામાં ગુરુવારે કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો હતો. છેલ્લાં 24 કલાકમાં ઓન્ટેરિયોમાં સૌથી વધુ 1135 કેસ નોંધાયા સાથે અહીં 19 દર્દીના મોત થયા હતા. જ્યારે ક્યૂબેકમાં કોરોનાથી 436 નાગરિકો સંક્રમિત થયા સાથે 10 દર્દીના મોત અને મોનિટોબામાં 297 નવા કેસ સાથે 8 દર્દીના મોત આરોગ્ય ખાતાએ નોંધ્યા હતા. એ જ રીતે બ્રિટીશ કોલંબિયામાં કોરોનામાં વધુ 378 લોકો સપડાયા હતા. અહીં આજે 7 દર્દીઓએ કોરોનાની સારવાર દરમિયાન જ દમ તોડી દીધો હતો. નોવા સ્કોશિયામાં નવા 118 દર્દી મળવા સાથે 216 દર્દી રિકવર થયા હતા. જ્યારે ન્યુબ્રુન્સ્વીકમાં આજે નવા 9 દર્દી કોરોના પોઝિટિવ તરીકે ઓળખાયા હતા. ન્યુબ્રુન્સ્વીકમાં ગુરુવારે વધુ 6 દર્દીએ કોરોનાને માત આપી હતી. ગુરુવારે નવા નોંધાયેલા તથા રિકવર થયેલા દર્દીઓનો તાગ મેળવાતા સાંજે દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 43444 નોંધાઈ હતી.

ઓન્ટેરિયોમાં શાળાઓ ફરીથી શરૂ કરવા નિષ્ણાંત તબીબની ભલામણ

ટોરોન્ટો : ઓન્ટેરિયોના ટોચના ડોક્ટર ડેવિડ વિલીયમ્સે મંગળવારે કહ્યું હતું કે, તેઓ ઈચ્છે છે કે, બાળકો ફરીથી ક્લાસરૂમમાં જઈને અભ્યાસ શરૂ કરી શકે. પ્રાંતમાં જુનના મધ્યથી શાળાઓ ફરીથી શરૂ કરવાનો નિર્ણય થઈ શકે છે. મહામારીની બાળકો ઉપર થનારી અસર વિશે સંશોધન કરી રહેલા જુથની રેતવણી વિશે ટીપ્પણી ડોક્ટર વિલીયમ્સે કરતા આમ કહ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે, મોટાભાગના બહેર આરોગ્ય યુનિટસ પ્રાંતમાં શાળાઓ ફરીથી શરૂ થાય એ બાબતે ટેકો આપી રહ્યો છે અને માની રહ્યો છે કે, શાળાઓ બંધ ન રહેવી જોઈએ. જે એપ્રિલથી બંધ થઈ ચુકી છે. હું પણ બહેર આરોગ્ય અધિકારીઓએ સુચવેલા સાવચેતીના પગલાઓ સાથે સહમત છું. હું એવું માનું છું કે, શાળાઓ ખુલશે તો બહાર નિકળવાનો માર્ગ આપોઆપ ખુલી જશે. મહામારીથી બહાર

આવવાનો આ સરળ માર્ગ છે. તેમણે કહ્યું કે મહામારીથી સૌથી વધુ અસર પામેલી ટોરોન્ટો સહિતની ઘણી બહેર આરોગ્ય સંસ્થાઓ પણ ઈચ્છે છે કે, હવે શાળાઓ ખુલી જવી જોઈએ. ત્રીજા વેવમાં કોવિડ-૧૯ના કેસોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે અને ઓન્ટેરિયોમાં હવે સ્ટે એટ હોમનો અમલ છે. વેક્સીનેશનમાં પણ ૮.૨ મિલીયન લોકોને પહેલો ડોઝ અપાઈ ચુક્યો છે. એપ્રિલમાં જ્યારે શાળાઓ બંધ કરવામાં આવી હતી, ત્યારની સરખામણીમાં સ્થિતિ હવે સારી છે. ત્યારે શાળાઓ ફરીથી શરૂ થાય એને ટેકો આપવો જરૂરી છે. સાવચેતીના તમામ પગલાઓ સાથે શાળાઓ ફરીથી શરૂ થાય તો બધાની સુરક્ષા પણ થઈ શકશે. વિલિયમ્સે એમ પણ કહ્યું હતું કે, શાળાઓ શરૂ થાય તો અભ્યાસ સિવાયની પ્રવૃત્તિઓ પણ થઈ શકે છે. જે બાળમાનસને મદદરૂપ બની શકે.

કોરોનાને રોકવા માટે બનાવાયેલો સ્ટ્રે 99 ટકા કારગત હોવાનો દાવો

નવી દિલ્હી : વેક્સિનેશન જ કોરોના સામે લડવાનું સૌથી અસરકારક હથિયાર માનવામાં આવે છે, પરંતુ ભારત જેવા મોટી વસ્તીવાળા દેશમાં એટલી ઝડપથી તમામને વેક્સિન ન લગાવી શકાય. આ દરમિયાન કેનેડાની કંપની 'સેનોટાઇઝ'નો એક નેગલ સ્ટ્રે સમગ્ર દુનિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. સેનોટાઇઝનો દાવો છે કે, આ નેગલ સ્ટ્રે બ્રિટન અને ન્યૂઝીલેન્ડમાં ક્લિનિકલ ટ્રાયલની પ્રોસેસમાંથી પસાર થઈ ચૂક્યો છે. જેમાં એ ૯૯ ટકા કારગત રહ્યો. આ નેગલ સ્ટ્રે કેવી રીતે કામ કરે છે ? ભારતમાં ક્યાં સુધીમાં આવશે ? કિંમત કેટલી હશે ? આવા કેટલાક સવાલો અંગે આ નેગલ સ્ટ્રે બનાવતી કંપની સેનોટાઇઝના ફાઉન્ડર ગિલી રેગેવે સાથે વાત કરી છે.

કેનેડામાં વસતા નાગરબંધુઓ દ્વારા હાટકેશ્વર જયંતીની શ્રદ્ધાપૂર્વક ઉજવણી



ટોરોન્ટો : રવિવાર તા. ૯ મે, ૨૦૨૧ના રોજ કેનેડામાં વસતા નાગર બંધુઓ દ્વારા આનંદ અને ઉલ્લાસ સાથે આરાધ્ય હાટકેશ્વર જયંતીની ઉજવણી કરાઈ હતી. આમ તો વર્ષ ૨૦૨૧માં હાટકેશ્વર જયંતિ તા.૨૬ એપ્રિલના રોજ હતી. પરંતુ હાલની કોરોનાને કારણે સર્જાયેલી વિષમ પરિસ્થિતિમાં આ જયંતિ ઉજવી શકાય તેમ ન હતું. તેથી ગત રવિવારે નાગરબંધુઓએ પોતપોતાના ઘરે બેસીને પૂજન કર્યું હતું. કમિટીના સભ્યો શૈલવ મહેતા, ધ્વનિત વેદ, ધવલ જોષી, નંદીશ વસાવડા, શિવાનીબેન દિવકર અને ક્રિષ્ના દોષીના પ્રયાસને કારણે રવિવાર તા.૯ મે, ૨૦૨૧ના રોજ વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ગલ્ફ સ્થિત સર્વ કર્મશાસ્ત્રી કેયુરભાઈ ઉપાધ્યાયે વિનંતીને આવકારી પૂજન કરાવવાની જવાબદારી સ્વીકારી હતી. તેમણે આગવી શૈલીથી પોડશોપચાર

વિધિ પૂર્વક પૂજન કરાવી સમસ્ત નાગર સમાજને શ્રદ્ધા ભક્તિથી તરબોળ કરી દીધા હતા. પૂજનમાં લગભગ ૫૦ પરિવારે ભાગ લીધો હતો. ભાગ લેનાર દરેક પરિવાર એક લીંકથી જોડાયા અને કેયુરભાઈના માર્ગદર્શન પ્રમાણે દરેક પરિવારે સ્વગૃહે જ શ્રીહાટકેશ્વર મહાદેવના પુજનનો લાભ લીધો હતો. કેયુરભાઈએ વિવિધ વૈદિક શ્લોકો અને શિવ મહિમ્ન સ્તોત્રના સુંદર ગાન સાથે એક અલગ જ વાતાવરણ સર્જ્યું હતું. આ ઉમદા પ્રયાસથી પ્રેરાઈને India,

USA, Australia, England સ્થિત કેટલાક નાગર બંધુઓએ પણ આ પૂજનનો લાભ લીધો હતો. આ પ્રસંગે નાગર પરિવારના શૈલીબેન મજમુદાર તેમજ સરયુબેન વત્સરાજે પ્રસંગોચિત ઉદબોધન કરી આ સમગ્ર કાર્યને અને કમિટીની વૈવિધ્યતાપૂર્ણ પ્રવૃત્તિઓને બિરદાવી હતી.

એસ્ટ્રાએન્કા વેકસીન લેનારનું બ્લડ ક્લોટથી મૃત્યુ

ટોરોન્ટો : ઓન્ટેરિયોના આરોગ્ય ખાતાના અધિકારીઓએ એપ્રિલ માસમાં કોવિડ-૧૯ની એસ્ટ્રાએન્કા વેકસીન લેનારા એક વ્યક્તિનું બ્લડ ક્લોટને કારણે થયેલા મૃત્યુને સમર્થન આપતા કહ્યું હતું કે, જવલ્લે જ જોવા મળતા બ્લડ ક્લોટને કારણે ઓન્ટેરિયોમાં આ પ્રથમ મૃત્યુ નોંધાયું છે. એસોસિયેટ ચીફ મેડીકલ ઓફિસર ઓફ હેલ્થ ડો. બાર્બરા યોર્કે પ્રાંતની કોવિડ સંબંધી સ્થિતિ વિશેના અર્થ સાપ્તાહિક બ્રિફિંગમાં મંગળવારે જણાવ્યું હતું કે,

કમનસીબે મારે એ વાત જણાવવી પડે છે કે, ઓન્ટેરિયોમાં વીઆઈટીટી સાથે સંકળાયેલું પ્રથમ મૃત્યુ થયું છે. મરનાર વ્યક્તિ યાળીસીએ પહોંચેલો પુરૂષ હતો, જેણે એસ્ટ્રાએન્કાનો પહેલો ડોઝ એપ્રિલના છેલ્લા અઠવાડિયામાં લીધો હતો અને થોડા અઠવાડિયા બાદ એવું મૃત્યુ થયું હતું. એના મૃત્યુના કારણોની તપાસ ચાલી રહી છે. આમ છતાં એક કારણ વીઆઈટીટી હોઈ શકે છે. જેમાં બ્લડ ક્લોટ થઈ જાય છે.

The North Star Insurance Inc.
For all your Insurance & Investment needs
Are you planning to invite family members to Canada?
Are you planning to travel outside Canada?

Visitors Insurance
Travel Insurance
Super Visa Insurance

* Pre existing medical conditions coverage * Monthly pay plans
* Full refund if visa denied * Pro rated refund for early return
* Reduced premium plans with deductible

Make your investment plans, meaningful with **T.F.S.A** **RRSP** **RESP**
Call today for a free no obligation quote
Jagdish Patel
(Agency Owner, Insurance Advisor)
647-470-1673
northstar.inc19@gmail.com

Protect Yourself, your family, investment & your valuable assets through
Life Insurance
Critical Illness Insurance
Disability Insurance

Better Commission package
One on one basis support
Hiring new & experienced insurance advisor
Weekly product training
Full flexibility

THINKING OF INVESTING?

INVEST AS LOW AS \$50,000 IN REAL ESTATE

SECURED INVESTMENT with up to 8-12% Guaranteed Return

We have multiple avenues for investment in Residential Properties, Commercial Properties or Construction Projects plus your investment is secured against the assets.

રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્રોપર્ટી અથવા કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ્સ માં અમારી પાસે ઘણાં જુદા જુદા રોકાણોનો વિકલ્પ છે જ્યાં તમને રોકાણ પર ૮-૧૨% સુધીનું વળતર અને તમારું રોકાણ સંપત્તિ સામે સુરક્ષિત હોય છે.

CALL 416 893 4585 TODAY!!!

આપના વિશ્વાસુ અને ભરોસાપાત્ર
અમારી રીયલ એસ્ટેટ અને ઇન્વેસ્ટમેન્ટ ની મફત સલાહ નો લાભ ઉઠાવવા માટે આજે જ સંપર્ક કરો.

Call us TODAY for all of your Real Estate Needs and get Honest, Reliable and Courteous Service you can count on.

- ✔ Residential
- ✔ New Construction
- ✔ Investment
- ✔ Commercial

MOHAMMAD ABOWATH SALES REPRESENTATIVE MAAZ ABOWATH BROKER IBRAHIM ABOWATH SALES REPRESENTATIVE

416 893 4585

ABOWATH
REAL ESTATE GROUP

VALUING RELATIONSHIPS OVER TRANSACTIONS EVERY SINGLE TIME!

ABOWATH.COM

#1 RE/MAX
#SellWithABOWATH your Local REALTOR
*Not intended to Solicit client under contract.



તંત્રી સ્થાનેથી

સોશિયલ મીડિયા ઉપર લગામ સરકારનો નેક ઈરાદો આવશ્યક

ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ 'ટૂલકિટ'નો ડબ્બો ઊભો કર્યો એ મુદ્દે ટ્વિટર અને નેચર મોદી સરકાર સામસામે આવી ગયાં છે.



તંત્રી - પ્રકાશક
સ્વદેશ

ફરમાન કર્યું હતું.

મંગળવારે રપ મેના રોજ આ ત્રણ મહિનાની મુદત પૂરી થઈ ગઈ છે. આમ છતાં ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ જેવાં તોર્નિંગ સોશિયલ મીડિયા સાઈટ સળવળાટ બતાવ્યો નથી. માત્ર ફેસબુકે નિયમો પાળવાની તૈયારી દાખવી છે. અત્યારે જે સ્થિતિ છે એ જોતાં મોટાભાગના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મોદી સરકારની વાત માનવા તૈયાર નથી. સરકારે કન્ટેન્ટ પર નિયંત્રણો માટે ઓફિસર્સ નિમવાની અને કમિટી બનાવવા સહિતની જે પણ જોગવાઈઓ કરાઈ છે તેનું એકાદ અપવાદને બાદ કરતાં કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પાલન કર્યું નથી. તેથી જોરદાર સંઘર્ષ જામવાનાં અંધાણ છે. સરકારે ફેબ્રુઆરીમાં બનાવેલા નવા નિયમો મુજબ બદનશીકારક, અશ્લીલ, બદનામી કરે એવું, ભેદભાવને પ્રોત્સાહન આપે એવું, સગીરો માટે નુકસાનકારક, દેશની એકતા, અખંડિતતા, સંરક્ષણ, સલામતી કે સાર્વભૌમત્વ માટે ખતરારૂપ કન્ટેન્ટ એટલે કે સામગ્રી નહીં મુકી શકાય. આ કન્ટેન્ટ રોકવાની જવાબદારી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સના માથે મુકાઈ છે. મોદી સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અને સાઈટ્સ માટે એક આચારસંહિતા નક્કી કરી છે અને તેનું તેમણે કડક રીતે પાલન કરવું પડશે એવું ફરમાન કર્યું છે. આ આચારસંહિતાના ભંગની ફરિયાદો માટે તંત્ર ઊભું કરાશે અને જે ડબ્બો પડ્યો છે એ આ તંત્રના મામલે જ પડ્યો છે. ભારત સરકાર નવા નિયમોના પાલન માટે જે માળખું બનાવવાની છે તેમાં એક કમિટી પણ હશે. આ કમિટીમાં સંરક્ષણ, વિદેશ, ગૃહ, માહિતી અને પ્રસારણ. ઈન્ફર્મેશન ટેકનોલોજી અને બાળ વિકાસ મંત્રાલયોના પ્રતિનિધિ હશે. આ કમિટી પાસે અમર્યાદિત સત્તાઓ છે અને ડબ્બો તેના કારણે જ પડ્યો છે. આ કમિટીની લાગે કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર કશુંક વાંધાજનક મુકાયું છે તો તે કંપનીના અધિકારીને બોલાવીને સુનાવણી કરી શકશે. આરોપો સાચા ઠરે તો તેને સજા કરવાની સત્તા પણ આ કમિટી પાસે છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને જે બીજો વાંધો છે એ સરકાર દ્વારા નિમાનારા 'ઓથોરાઈઝડ ઓફિસર' અને તેની સત્તાઓ સામે છે. સરકાર જોઈન્ટ સેક્ટરી કે તેનાથી ઉપરના લેવલના અધિકારીને 'ઓથોરાઈઝડ ઓફિસર' નિમશે. આ 'ઓથોરાઈઝડ ઓફિસર' પાસે કોઈ પણ કન્ટેન્ટને બ્લોક કરવાનો આદેશ આપવાની સત્તા હશે. આ 'ઓથોરાઈઝડ ઓફિસર'ના નિર્ણય સામે અપીલ કરી શકાશે પણ ત્યાં લગી કન્ટેન્ટ બ્લોક રહેશે. બીજો ડબ્બો આ કહેવાતા વાંધાજનક કન્ટેન્ટનો સોર્સનો છે. સોશિયલ મીડિયા સાઈટ કોઈ પણ વાંધાજનક કન્ટેન્ટ ક્યાંથી આવ્યું તેનું નામ પણ સરકારને આપવું પડશે ને સરકાર તેની સામે પગલાં ભરશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સનું કહેવું છે કે, અમે તો વચેટિયા છીએ અને કરોડો યુઝર્સ ધરાવીએ છીએ. તેમાંથી કોણે કન્ટેન્ટ મૂક્યું એ શોધવું અશક્ય છે, તેથી આ નિયમ પાળી શકાય તેમ જ નથી. વળી, કમિટીઓ સરકારના ઈશારે કામ કરશે. સરકારની કે સત્તાધારી પક્ષની

વિરૂદ્ધ કંઈ પણ સોશિયલ મીડિયા પર આવશે કે તરત હેરાનગતિ શરૂ કરાશે. આ નિયમોને કારણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સની આઝાદી પણ ઇનવાઈ જશે અને એ સરકારની કે સત્તાધારી પક્ષની ભાટાઈ કરનારું વાજિંત્ર બનીને રહી જશે.

આ દલીલ ખોટી નથી કેમ કે ભારતમાં સરકારી તંત્ર, એજન્સીઓને કાયદાનો દુરુપયોગ કરવામાં કોઈને શરમ નડતી નથી. ખરેખર તો આપણા સમાજમાં બેજવાબદારી, નાગરિકકર્મ અંગેના અજ્ઞાન, બદલાની ભાવના, નફરત ફેલાવવાના વ્યક્તિગત સ્વાર્થ જેવી સક્રિયતા મોજૂદ છે. જેની અભિવ્યક્તિ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા પણ થતી રહે છે. જ્યારે માહિતીના માધ્યમો સીમિત હતાં એટલે કે અખબાર કે ન્યૂઝ ચેનલો હતાં ત્યાં સુધી આવી અફવાઓ ફેલાવવી સીમિત હતી. પરંતુ આજે તો દરેકના હાથમાં સ્માર્ટ ફોન આવી ગયાં છે અને દરેક વ્યક્તિ પોતે પોતાને મનગમતી માહિતીની સત્યતા પારખ્યા વિના જ વહેતી કરી દેતી હોય, ત્યારે પ્રમાણિક બહારોની ચકાસણી કરવી અત્યંત મુશ્કેલ બની ગઈ છે.

સોશિયલ મીડિયાના મંચો પર થતી અભિવ્યક્તિ દેશના સાર્વભૌમત્વ કે પછી કોઈ વ્યક્તિની ગરિમાને નુકસાન પહોંચાડતી હોય, અશ્લીલતા અંગેના નિયમોની વિરુદ્ધ હોય તો તેને નિયંત્રિત કરવાની જરૂર છે, આપરાધિક મામલાઓમાં પણ નવા નિયમો સહાય કરી શકે છે. પરંતુ જાણકારોનું માનવું છે કે, એજન્સીઓ દ્વારા આ નિયમોના દુરુપયોગ થાય તો એને રોકવા માટે કોઈ જોગવાઈ દેખાતી નથી. સરકારને કોઈ માહિતી વાંધાજનક લાગે તો તે અંગે કંપનીઓએ પગલા લેવાના રહેશે. પરંતુ કેવી માહિતી વાંધાજનક હોઈ શકે એની કોઈ પરિભાષા નથી. સરકાર દ્વારા વાંધાજનક બતાવવામાં આવે એ કોઈ રીતે લોકશાહી કે પછી અભિવ્યક્તિના અધિકારને હાનિ પહોંચાડે એવી છે કે નહીં તે નક્કી કોણ કરશે તે પણ સ્પષ્ટ નથી. ટૂંકમાં વાંધાજનક માહિતીની વ્યાખ્યા કોણ નક્કી કરશે અને એમાં સંબંધિત પક્ષોને પોતાની રજૂઆત કરવાની તક હશે કે કેમ એ પણ મોટો સવાલ છે. આથી જ સરકારની મનષા સામે આમજનતામાંથી પણ સવાલો ઉઠવા માંડ્યા છે. આ ઉપરાંત ટૂવીટર, ફેસબુક જેવી મોટી સોશિયલ મીડિયા કંપનીઓ માટે માસિક રિપોર્ટ જાહેર કરવો ફરજિયાત હશે. આ રિપોર્ટમાં કંપનીઓએ બતાવવું પડશે કે તેમને કેટલી ફરિયાદો મળી અને એ ફરિયાદો અંગે તેમણે કેટલા સમયમાં કેટલી કાર્યવાહી કરી. કંપનીઓ જાતે કોઈ વાંધાજનક માહિતી દૂર કરી કે નહીં એ અંગે પણ સ્પષ્ટતા કરવી પડશે. જો કંપની નિયમોનું પાલન નહીં કરે તો કથિત માહિતી માટે તેમને જવાબદાર ઠરાવવામાં આવશે અને કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

હવે સરકાર અને સોશિયલ મીડિયા કંપનીઓ વચ્ચેનો વિવાદ કોર્ટમાં પહોંચી ગયો છે. વોટ્સએપે સરકાર વિરુદ્ધ દિલ્લી હાઈકોર્ટમાં અપીલ કરી છે કે, નવા આઈટી નિયમો રોકવામાં આવે. વોટ્સએપની દલીલ છે કે નવા નિયમોથી લોકોની પ્રાઈવસી જ ખતમ થઈ જશે. ભારે ગડમથલ બાદ ફેસબુકે તો સ્પષ્ટ કરી દીધું છે કે તે સરકારના નવા નિયમોનું પાલન કરશે. જોકે ફેસબુકે એમ પણ કહ્યું છે કે તે સરકાર સાથે વિચારવિમર્શ પણ ચાલુ રાખશે. પરંતુ સોશિયલ મીડિયાના તમામ મંચની જે પ્રકૃતિ રહી છે એ જોતાં તે વપરાશકર્તાઓની પ્રાઈવસી સાથે કેટલી બાંધછોડ કરે છે એ સવાલ છે. અત્યાર સુધી ફેસબુક કે ટૂવીટર જેવા મંચો પર લોકો જે રીતે મુક્ત રીતે પોતાના વિચારો વ્યક્ત કરી શકે છે.

મનોજ ગાંધી

manoj1968@yahoo.ca

INDEPENDENTLY OWNED AND OPERATED

JAY PATEL
BROKER

647.241.3818
jaypatel1323@gmail.com

"Let Me Make Your Dream Home Into A Reality"

Residential, Commercial & Investment in Real Estate

Off : 905.456.1000 | Fax : 905.456.1924
295 Queen Street East, Brampton, On., L6W 3R1

ARISTO PEST CONTROL
Set your mind at rest, we will get rid of the pest

647-339-3926 | aristopest@gmail.com | www.aristopestcontrol.com

✓ Mice
✓ Rat

✓ Cockroach
✓ Bedbug

SAME DAY SERVICE - RESIDENTIAL, COMMERCIAL, INDUSTRIAL

✓ Animal Control

✓ Bird Control

WE SPEAK ENGLISH, GUJARATI & HINDI

✓ WASPS and
✓ Hive Removal

24 HRS / 7 DAYS EMERGENCY SERVICES AND ANIMAL REMOVAL

We also provide No Obligation Inspection for Commercial and Residential Clients.
Written Guarantee And Discounted Rates

CALL SANKET TRIVEDI - 647.339.3926
Government Licensed Structural Exterminator

ગોવર્ધનથાળ

સ્વાદિષ્ટ શુદ્ધ શાકાહારી ગુજરાતી ભોજન

Weekend Special

રગડા પેટિસ, પાંઉભાજી,
છોલેપુરી, કટલેસ,
ખાસ્તા ક્યોરી,
સેવ ઉસળ, સમોસા ચાટ

Takeout & Catering

Limited થાળી
(with sweet & Farsan)

\$8.00 +Tax

Limited થાળી
(without sweet & Farsan)

\$6.50 +Tax



CATERING SPECIAL

\$ 7.99 10 items

+Tax

Sweet, Farsan, Subji,
Kathor, Puri, Dal, Rice
Papad, Pickle, Kachumber

Franchise
Opportunity
in GTA

Call us for details

રસોઈકામ
કરી શકે તેવા
બહેનોની જરૂર છે.

ફોન નં: ૪૧૬-૪૩૮-૦૫૪૪

૪૧૬-૫૨૦-૨૯૨૨, ૪૧૬-૪૩૪-૮૧૨૧

૯૪૦, મારખમ રોડ, સ્કારબોરો, ઓન્ટેરીયો, કેનેડા, M1H2Y2

દેશ-વિદેશથી ટોરન્ટો ભણવા આવતા ગુજરાતી
(વેજીટેરીયન) સ્ટુડન્ટ, ભાઈઓ તથા બહેનોની ખાસ
સગવડ માટે તુષાર શાહ તથા ગોવર્ધન થાળ શરૂ કરે છે

ગુજરાત ભવન

જેમાં આપને સ્પેશિયલ રૂમ, શેરીંગ રૂમ, ગુજરાતી વેજીટેરીયન ભોજન,
પ્રાઈવેટ બેડ, Wi Fi ઇન્ટરનેટ વગેરે સગવડો આપવામાં આવશે.



ગુજરાત ભવન

Quarantine
Special
Package

\$73 Per Day



Call : Tushar Shah - 416-434-8121

ગુજરાત ભવન - 416-913-7184

4694 Kingston Road, Scarborough.



ગુજરાતમાં કોરોનાથી 27 હજાર મોત : કોંગ્રેસ

અમદાવાદ

કોંગ્રેસે ગુજરાતમાં કોરોનાના મૃતકોની માહિતી એકત્ર કરવાનું શરૂ કર્યું છે, જે અંતર્ગત 15 દિવસના સમય ગાળામાં 27 હજાર જેટલા લોકોએ કોરોના મહામારીમાં પોતાના સ્વજનો ગુમાવ્યા છે તેની માહિતી ભરીને લોકોએ ફોર્મ સબમિટ કરાવ્યા છે, 10મી મે ના રોજ કોંગ્રેસે એક ગુગલ ફોર્મ જાહેર કર્યું હતું, જેમાં સ્વર્ગસ્થનું નામ, સરનામું, શહેર જિલ્લો, મૃત્યુનું સ્થળ, હોસ્પિટલનું નામ-સરનામું, મૃત્યુની તારીખ વગેરે માહિતી એકત્ર કરી છે. આ દિવસોમાં 17,300 કરતાં વધુ લોકોએ ઓનલાઈન ગૂગલ ફોર્મ સબમિટ કર્યાં છે, જ્યારે તાલુકા-જિલ્લા

કોંગ્રેસ સમિતિના માધ્યમથી પણ 10 હજાર જેટલા મેન્યુઅલ ફોર્મ ભરીને આવ્યા છે તેમ બુધવારે યોજાયેલી પત્રકાર પરિષદમાં કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, અમને જે માહિતી મળી છે તે મુજબ 22 ટકા લોકોએ એવી માહિતી આપી છે કે તેમના સ્વજનનું મૃત્યુ ઘરે થયું છે, 77.3 ટકા લોકોએ મૃત્યુ હોસ્પિટલમાં થયાનું જણાવ્યું છે, સરકારની અણઆવડતને કારણે, ઓક્સિજનના અભાવે, યોગ્ય સમયે સારવાર નહિ મળવાના કારણે, ઈન્જેક્શન નહિ મળવાના કારણે, વેન્ટિલેટર નહિ મળવાના કારણે અનેક લોકોના જીવ ગયા છે.

ગુજરાતમાં કોરોનાના 2869 કેસ-33નાં મોત, એક્ટિવ કેસ 50 હજારથી નીચે

અમદાવાદ : ગુજરાતમાં કોરોનાની બીજી લહેર સતત નબળી પડી રહી છે. ગુરુવારે કોરોનાનાં 2869 કેસો અને 33 દર્દીઓનાં મોત નોંધાયા હતા. જ્યારે 9302 દર્દીઓ સાજા થયા હતા. અને આજે પણ રાજ્યમાં 2,26,603 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં કોરોના કેસોનો કુલ આંક

7,97,222 પર પહોંચ્યો છે. જ્યારે મોતનો કુલ આંક 9734 પર પહોંચ્યો છે. અને કુલ 7,20,050 દર્દીઓએ કોરોનાને માત આપી છે. અને રાજ્યનો રિકવરી રેટ વધીને 92.66 ટકા પર પહોંચ્યો છે. હાલ રાજ્યમાં કુલ એક્ટિવ કેસોનો આંક 50 હજારથી નીચે પહોંચી ગયો છે. હાલ રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા

49,082 પર પહોંચ્યો છે. જેમાંથી 583 દર્દીઓ વેન્ટિલેટર પર છે, અમદાવાદમાં નવા 352 કેસ, 6નાં મોત, વડોદરામાં નવા 530 કેસ, 4નાં મોત, સુરતમાં નવા 323 કેસ, 4નાં મોત, રાજકોટમાં નવા 173 કેસ, 2નાં મોત, જામનગરમાં નવા 69 કેસ, 2નાં મોત, ગાંધીનગરમાં નવા 58 કેસ, એકનું મોત થયું હતું.

પાટણમાં મહિલાએ બે વર્ષની પુત્રી અને માતાને બાંધીને નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું

પાટણ

પાટણના ચાણસ્માથી એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મહિલાએ પોતાની 2 વર્ષની પુત્રી અને માતાને પોતાની સાથે બાંધી નર્મદા કેનાલમાં ઝંપલાવી દીધું હતું. આ વાત વાયુવેગે ફેલાઈ ગઈ હતી. જેને કારણે મોટી સંખ્યામાં લોકો કેનાલ પર એકત્ર થઈ ગયા હતા. પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. અને તરવૈયાઓની મદદથી તપાસ અભિયાન શરૂ કર્યું હતું.

પાટણના ભુલપુરા ગામની એક મહિલા પોતાની બે વર્ષની પુત્રી અને પોતાની માતા સાથે નર્મદા કેનાલ પાસે પહોંચી હતી. અને માતા અને દીકરીને પોતાની સાથે બાંધી નર્મદા કેનાલમાં ઝંપલાવી દીધું હતું. આ વાતની જાણ થતાં જ જે લોકો દોડી આવ્યા હતા. અને અમુક લોકોએ કેનાલમાં કૂદીને તેઓની શોધખોળ પણ હાથ ધરી હતી. ઘટનાસ્થળેથી મહિલાનું એક ટુચીલર મળી આવ્યું હતું. મહિલાના પતિએ આ ટુચીલર

પોતાનું હોવાનું જણાવ્યું હતું. મહિલાના આપઘાતના કેસ મામલે પોલીસ પણ તાબડતોડ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અને કાર્યવાહી હાથ ધરી હતી. પણ સાંજ પડવા સુધી પણ મહિલા અને દીકરી તેમજ માતા મળી આવ્યા ન હતા. આ ઘટનાની જાણ મૃતકના ગામમાં થતાં સૌ કોઈ આઘાતમાં ગરકાવ થઈ ગયા હતા. અને સમગ્ર ગામમાં ગમગીની છવાઈ ગઈ હતી. આ મામલે હજુ પણ તપાસ અભિયાન ચાલુ છે.

અસરગ્રસ્ત ખેડૂતોના દેવાં માફ કરો : કોંગ્રેસની સરકારને અપીલ

ગાંધીનગર

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની આગેવાની હેઠળ ભરતસિંહ સોલંકી, વિપક્ષી નેતા પરેશ ધાનાણી, અર્જુન મોઢવાડિયા અને સિદ્ધાર્થ પટેલ સહિતના નેતાઓએ ગુરુવારે રાજ્યપાલ દેવવ્રત આચાર્યને રૂબરૂ મળીને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં કોરોના મહામારી-વાવાઝોડાથી અસરગ્રસ્ત ખેડૂતોને સહાય આપવા માંગ કરાઈ હતી. આવેદનમાં કોંગ્રેસે વાવાઝોડાથી સ્થળાંતરિત લોકોને પરિવારદીઠ રૂ. ૧,૦૦૦ કેશડોલ્સ ચૂકવવા, કાયા-

પાકાં મકાનો-ઝૂંપડાંવાળાઓને વરવખરી નુકસાન પેટે રૂ. ૨૫,૦૦૦ ચૂકવવા તથા મકાન સહાય પરિવારદીઠ રૂ. ૨.૫૦ લાખ આપવા માંગ કરી હતી. આ સાથે જ કોરોના મહામારી અને વાવાઝોડાથી અસરગ્રસ્ત ખેડૂતોની લાંબા-ટૂંકા-મધ્યમગાળાની બેન્ક લોનો માંડવાળ કરવા તથા વાવાઝોડાથી પડી ગયેલા આંબાદીઠ ૨.૮૦ લાખ અને નાળિયેરી દીઠ રૂ. ૩૩ હજાર તથા વેપાર-ઉદ્યોગ, કારખાનાના શેડ, ગોડાઉન, અગરિયાને વગર વ્યાજની લોન આપવા સરકારને વિનંતી કરાઈ હતી.

THANK YOU FRONTLINE WORKERS

**MORTGAGE DILIGENT**
A STEP AHEAD

FSRA # 10252

⇒ Purchase ⇒ Refinance ⇒ Renewal/Switch

5 Yrs Fixed @ 1.60%* High Ratio Only
5 Yrs Variable @ 1.14%* High Ratio Only**Rakesh Patel****
Vice President- Commercial.**Pranay Jani *****Nilesh Tailor *****Tushar Patel*****Bala Shah*****Vijay Rana*****Rajesh Khurana, MBA**
Principal Broker

Tel.: 289 521 6900

1305 Matheson Blvd E, Mississauga ON L4W 1R1

• info@mortgagediligent.com • www.mortgagediligent.com

Cell : 416-616-1300

વિસનગર પાલિકાના પ્રમુખને ઉથલાવવાનો પ્રયાસ નિષ્ફળ

ગાંધીનગર રજુઆત માટે જવાનું કહી સભ્યોને એકઠા કર્યા

વિસનગર વિસનગર નગરપાલિકા પ્રમુખના વિરોધમાં તેમને ઉથલાવવા સભ્યોને એકઠા કરવામાં આવ્યા હતા. ત્યારે હોબાળો થતા પાણીના પ્રશ્ને મીટીંગ બોલાવી હોવાનું બહાનું બતાવી પ્રમુખ વિરોધની ચળવળનો નાટકીય અંત આવ્યો હતો. ત્યારે લોકોની સમસ્યાઓ દૂર કરી વિકાસ કામ કરવાની જગ્યાએ એકબીજાને પાડવાનું રાજકારણ શરૂ થતા અટકળો તેજ બની છે.

વિસનગર પાલિકા પ્રમુખ વર્ષા પટેલ તથા ઉપપ્રમુખ રૂપલ પટેલ વચ્ચેનો ભૂગર્ભમાં ચાલતો વિખવાદ હવે સપાટી ઉપર આવી ગયો છે. સોમવારની રાત્રે ભાજપના પાલિકા સભ્યોને મંગળવાર સવારે ગાંધીનગર જવાનું હોવાથી સવારે ૯-૦૦ કલાકે ધારાસભ્ય કાર્યાલય એકઠા થવાની જાણ કરાઈ હતી. ધારાસભ્ય સાથે ગાંધીનગર જવાનું હોવાનું જાણી સભ્યો ધારાસભ્ય પટેલના કાર્યાલયમાં આવી ગયા હતા. બીજા બાજુ પ્રમુખ વર્ષાબેન પટેલને ઉથલાવવા મીટીંગ બોલાવી હોવાની

વડોદરા કોર્પોરેશનમાં કોંગ્રેસના નેતા પદ માટેનું કોર્કડું ગૂંચવાયું

વડોદરા: વડોદરા કોર્પોરેશનમાં કુલ ૭૬ બેઠકમાંથી ભાજપે ૬૯ અને કોંગ્રેસે ૭ બેઠક જીતી છે. વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા માટે પ્રદેશ કોંગ્રેસ હજી સુધી નિર્ણય લઈ શકી નથી. કોર્પોરેશનમાં બોર્ડની ઘણી મીટિંગ મળી છે. આ મીટિંગો કોંગ્રેસના નેતા, ઉપનેતા અને દંડક વિના ચાલી છે.

જોકે કોંગ્રેસના ચૂંટાયેલા ૭ સભ્યમાંથી પાંચને નેતા બનવાની ઈચ્છા છે. કોર્પોરેશનમાં જેટલી બેઠક હોય તેના ૧૦ ટકા બેઠક હરીફ પક્ષ જીતે તો તેને વિરોધ પક્ષના નેતાનું પદ મળે છે. વડોદરામાં કોંગ્રેસ ૧૦ ટકા બેઠક જીતી શકી નથી. અગાઉ કોર્પોરેશનની સભામાં કોંગ્રેસે વિપક્ષના નેતાની માગ કરતી દરખાસ્ત પણ મૂકી હતી. જોકે શાસક પક્ષની એવી દરખાસ્ત હતી કે ૧૦ ટકાથી વધુ અને ઓછામાં ઓછી ૮ સીટ નથી એટલે કોંગ્રેસને વિપક્ષ તરીકે માન્યતા ન મળતા વિપક્ષના નેતાનું પદ કોઈને નહીં મળે.

છૂટાછેડા આપ, નહીં તો આપઘાતમાં તારું નામ આપીશ કહી પત્નીને ધમકી

વડોદરા વડોદરા શહેરની યુવતીના લગ્ન સંખેડા રહેતા શિક્ષક સાથે થયા બાદ સાસરિયાઓ દ્વારા અવાર નવાર યુવતીને શારીરિક અને માનસિક ત્રાસ આપી હેરાનગતિ કરવાનો બનાવ મહિલા પોલીસ મથકે નોંધાયો છે પોલીસે આ મામલે સાસરી પક્ષના પાંચ સભ્યો વિરુદ્ધ સ્ટ્રી અત્યાચારની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા શહેરના વાઘોડિયા રોડ ઉપર રહેતી ૩૦ વર્ષીય મહિલાએ નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમણે અગાઉ છૂટાછેડા લીધા બાદ બીજા લગ્ન દીપકકુમાર વણકર (રહે -સંખેડા ગામ, છોટાઉદેપુર) સાથે કર્યા હતા. તેમના પતિ શિક્ષક તરીકે ફરજ બજાવે છે લગ્ન પછી પતિ ફરવા લઈ જતો ન હતો. ઘર છોડીને ક્યાં જવાનું નહીં. મોબાઈલ વાપરવું નહીં. પિયર જોડે વાત કરવાની હોય તો પતિની હાજરીમાં કરવાની તેવા નિયમો સાસરી પક્ષમાં હતા. સસરા પ્રિન્સિપાલની ફરજમાંથી નિવૃત્ત થયા છે. સાસરિયાઓ કામવાળી ની માફક કામકાજ કરાવી પૂરતું જમવાનું આપતા ન હતા. અને પતિને ખોટી કાનભંભેરણી કરતા હતા. નવરાત્રિના તહેવારોમાં પતિ રાત્રે ત્રણ વાગ્યા સુધી ઘરે નહીં આવી પત્નીને ગરબા રમવા મોકલતો ન હતો. પતિ અવારનવાર ઢોરમાર મારી ઘરની બહાર કાઢી ઘરનો દરવાજો બંધ કરી દેતો હતો. નણદોઈ સંજયભાઈ વણકર હું વકીલ છું તારી સામે ખોટા કેસ કરીને તમને ફસાવી દઈશ પોલીસ વાળાને તો બિસ્સામાં લઈને ફરું છું તેવી ધમકી આપતો હતો. પતિ જણાવતો કે મા બાપના કહેવાથી તારી સાથે લગ્ન કર્યા છે તારામાં કોઈ રસ નથી પત્ની તરીકે સ્વીકારવાનો પણ નથી તું મારાથી છૂટાછેડા આપી દે નહીં તો તને બદનામ કરી અને હું પણ આપઘાત કરીને મરી જઈશ અને તારું નામ લખીશ. પતિએ ખોટા આક્ષેપો સાથે છૂટાછેડા માટેનો દાવો કોર્ટમાં દાખલ કર્યો છે. પતિના અન્ય સ્ટ્રી સાથે સંબંધ હોવાની શંકા છે.

કંપનીનો મેલ હેક કરી ટ્રાન્સફર કરાવેલા 1.94 કરોડ જર્મન પોલીસે પરત અપાવ્યા

વડોદરા જર્મનીની ટર્ગો બેન્કની ડિટેલ મોકલી રકમ ટ્રાન્સફર કરાવી લીધી હતી. શિપની સર્વિસ આપતી બ્લુ મરીન કંપનીએ પેમેન્ટ નહીં મળ્યું હોવાની ફરિયાદ કરતાં કંપનીએ તપાસ કરી હતી. આ રકમ એસબીઆઈ મારફતે ડોલરમાં ટ્રાન્સફર કરાવી હોવાથી તેનું પેમેન્ટ વાયા ન્યુયોર્ક થઈ જર્મનીની બેન્કમાં ગયું હતું. સાયબર સેલના એસીપી હાર્દિક માંકડિયાએ કહ્યું હતું કે, અમે તુર્તજ એક્ઝાઈઆર નોંધી લેટર ડ્રાફ્ટ કર્યો હતો. જે લેટર એસબીઆઈ તેમજ જીએસીએલ કંપની મારફતે એમ્બેસીની મદદથી જર્મન પોલીસને મોકલી સંકલન કરતાં તેમણે આ રકમનું સ્ટોપ પેમેન્ટ કરાવી તમામ રકમ પરત ટ્રાન્સફર કરાવી છે.

વડોદરાની જીએસીએલ કંપનીએ શિપમાં મોકલેલા કોસ્ટિક સોડાના ભાડાની રૂ. ૧.૯૪ કરોડની રકમનું પેમેન્ટ સાયબર માફિયાએ મેલ હેક કરી જર્મનીની બેન્કમાં ટ્રાન્સફર કરાવી લેતાં વડોદરા સાયબર સેલ અને સ્ટેટ બેન્ક, જીએસીએલના સંકલનના કારણે જર્મન પોલીસે આ રકમ પરત અપાવી છે.

લુણાવાડા પાલિકાના પ્રમુખે રાજનામું આપતા રાજકારણ ગરમાયું

લુણાવાડા મહીસાગર જિલ્લાના લુણાવાડા નગરપાલિકાના પ્રમુખે આજે સાંજે પાંચ વાગે ચીફઓફિસર સમક્ષ પ્રમુખ પદેથી રાજનામું સોંપી દેતા સ્થાનિક રાજકીય ક્ષેત્રે ગરમાવો આવી ગયો છે. એનસીપીના બિન્દાબેન શુક્લ ૩ ભાજપ, ૧ અપક્ષ અને ૧૪ કોંગ્રેસના સભ્યોના ટેકાથી લુણાવાડા નગરપાલિકાના પ્રમુખ પદે નિયુક્ત થયા હતા. પરંતુ આજે સાંજે તેમણે અચાનક રાજનામું આપી દેતા રાજકીય ક્ષેત્રે અનેક ચર્ચાઓ થઈ રહી છે. જો કે રાજનામા અંગે પ્રમુખે કહ્યું કે કોઈના દબાણ કે કોઈ કારણોસર નહીં પણ મેં સ્વૈચ્છિક રાજનામું આપ્યું છે. બીજી તરફ પ્રમુખે રાજનામું આપતા જ ભાજપ દ્વારા પોતાની નગરપાલિકા બનાવવાના પ્રયાસો શરૂ કરી દીધા છે.

10 ફૂટની દીવાલ કૂદી ભાગેલો ડબલ મર્ડરનો આરોપી આખરે ઝડપાયો

વડોદરા કારેલીબાગની હોસ્પિટલમાં સારવાર માટે લવાયેલા ડબલ મર્ડર કેસનો આરોપી આખરે આરોપી હાલોલ ખાતેથી ઝડપાઈ ગયો હતો. પંચમહાલ જિલ્લાના શહેર તાલુકાના સંભાળી ગામે રહેતા જયંતિ પ્રતાપભાઈ નાયકને કામધંધો કરવા માટે કાકા-કાકીએ ઠપકો આપતાં તેણે તિક્ષણ હથિયારના ઘા ઝિંકી બંનેની હત્યા કરી હતી. જે ગુનામાં તેને ગોધરાની સબ જેલમાં રખાયો હતો. હત્યારા જયંતિ નાયકની માનસિક સ્થિતિ યોગ્ય નહીં હોવાથી કોર્ટના આદેશથી તેને વડોદરા સારવાર માટે લવાયો હતો. કારેલીબાગની હોસ્પિટલમાં સારવાર દરમિયાન ગઈકાલે બપોરે તે ટોચલેટ જવાના બહાને હાથકડી ખોલતાં જ પોલીસને ધક્કો મારી ભાગી છૂટ્યો હતો.

Imperial

PEST CONTROL

Residential • Commercial • Industrial

24 Hour Service • 7 Days a Week

Preventing the Spread of COVID-19 :
Our disinfectant services that we offer are:

1 Spray Services

2 Fogging Services

3 Sanitation Services

All Pest Control:

Mouse & Rats, Cockroaches, Bedbugs, Silver Fish, Spiders & Fleas, Carpenter Ants.
Total Interior & Exterior Pest Control

Removal:

Bees & Wasps, Pigeon, Squirrels, Raccoon, Skunk, Nest & Hive, Hornests, Yellow Jackets

First Time Customer gets

10% Off

on your first home service

*Mention this offer while booking

Free Estimates & Written Guarantee

Special Service For Bedbug Control

www.imperialpestcontrol.ca
info@imperialpestcontrol.ca
(We speak English, हिन्दी, ગુજરાતી)

Call: Ramesh Kanani 416-837-1820



અનુરાગ કશ્યપને હાર્ટ એટેક: સર્જરી કરાઈ

ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા નિર્દેશક અનુરાગ કશ્યપની ગત રવિવારે તબિયત ખરાબ હતી. છાતીમાં અચાનક દુ: ખાવો થવાને કારણે તેમને મુંબઈની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ચેક-અપ કર્યા પછી જાણવા મળ્યું કે તેના હાર્ટમાં બ્લોકેજ છે, જેના કારણે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. ખો કે, તબીબોએ પરિસ્થિતિ સંભાળી લીધી હતી અને સર્જરી કરાતા હવે ક્રિસ્ટલરની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે.



સ્વદેશ



પ્રિયંકા બિલબોર્ડ મ્યુઝિક અવોર્ડના રેડ કાર્પેટ પર છવાઈ

મુંબઈ: મ્યુઝિકની દુનિયાનો જાણીતો અવોર્ડ એટલે બિલબોર્ડ મ્યુઝિક અવોર્ડ. આ અવોર્ડ ફંક્શનના રેડ કાર્પેટ પર 'દેશી ગર્લ' પ્રિયંકા ચોપરા જોનસ છવાઈ ગઈ હતી. બિલબોર્ડ મ્યુઝિક અવોર્ડમાં પ્રિયંકા ચોપરા હાઈ લેગ સ્લિટવાળા ન્યૂડ શેડના ડ્રેસમાં જોવા મળી હતી. પ્રિયંકાના આ ડ્રેસમાં લાગેલા ગોલ્ડન રંગના ક્રિસ્ટલ અને કોસેટ બેલ્ટ આઉટફિટની સુંદરતા ઓર વધારતા હતા. પ્રિયંકા ચોપરાએ આ ડ્રેસ સાથે મોંઘી જ્વેલરી પણ પહેરી હતી. મીડિયા રિપોર્ટ પ્રમાણે, પ્રિયંકાએ ૪૦ કેરેટની ડાયમંડ જ્વેલરી પહેરી હતી. પ્રિયંકા ચોપરાએ ફેન્સને પોતાની જ્વેલરીની ઝલક આપતી તસવીર ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરી હતી. પ્રિયંકાએ પોતાના હાથની તસવીર શેર કરી હતી. જેમાં સાપના મુખવાળું ડાયમંડ જડિત હેન્ડ-કફ જોવા મળે છે. યુએસ વીકલીના રિપોર્ટ પ્રમાણે, પ્રિયંકાના આ રોઝ ગોલ્ડ બ્રેસલેટનું કુલ વજન ૨૪.૯ કેરેટ છે જ્યારે રોઝ ગોલ્ડ ઈયરિંગ્સનું વજન ૧૪.૧૮ કેરેટ છે. પ્રિયંકાએ પોતાના નખમાં પણ નાના ડાયમંડ્સ લગાવ્યા હતા. બિલબોર્ડ મ્યુઝિક અવોર્ડમાં પોતાના અને પતિના લૂકની ઝલક બતાવતી તસવીરો પણ પ્રિયંકાએ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. પ્રિયંકાનો આઉટફિટ કમાલનો હતો ત્યારે ગ્રીન સૂટમાં નિક જોનસનો લૂક પણ આકર્ષક હતો.

સંજય દત્ત બન્યો UAEના ગોલ્ડન વીઝા મેળવનાર પહેલો ભારતીય અભિનેતા



સંજય દત્તને UAE ગોલ્ડન વીઝા મળ્યા છે. સંજય દત્તે સોશિયલ મીડિયામાં આ અંગેની માહિતી આપી હતી. તસવીરમાં સંજય દત્ત UAEના ડિરેક્ટર જનરલ મોહમ્મદ અહમદ અલ મારી સાથે જોવા મળે છે. સંજય દત્તે UAE સરકારનો આભાર પણ માન્યો છે. ફ્લાઈ દુબઈના COO હમદ ઓબૈદલ્લાના સમર્થન માટે આભારી છે. આ માહિતી અંગે જણાવતા સંજય દત્તે બે તસવીરો પણ શેર કરી છે. જેમાં તેઓ પાસપોર્ટ પકડીને મેજર જનરલ મોહમ્મદ અલ મારીની સાથે દેખાયા. આપને જણાવી દઈએ અલ મારી દુબઈમાં જનરલ ડાયરેક્ટર ઓફ રેસિડન્સી એન્ડ ફોરેન અફેર્સના ડાયરેક્ટર જનરલ છે. સંજય દત્ત બોલિવુડના એ કેટલાંય સ્ટાર્સમાંથી છે જે મોટાભાગે દુબઈ આવતા જતા રહે છે. સપ્ટેમ્બર 2020માં પોતાની પત્ની માન્યતા સાથે દુબઈ ગયા હતા.



લોકો મને ખરાબ મહિલા સમજવા લાગ્યા હતા: મલ્લિકા

'ખ્વાહિશ' અને 'મર્ડર' જેવી ફિલ્મોમાં જોવા મળી રહેલી આ અભિનેત્રી તેની બોલ્ડનેસ માટે જાણીતી છે, પરંતુ ફિલ્મોમાં બોલ્ડ સીન્સ માટે તેને લોકોના મ્હેણા ટોણા સાંભળવા પડ્યા હતા. જોકે આ દિવસોમાં અભિનેત્રી ફિલ્મ જગતથી ઘણી દૂર છે. હવે તાજેતરમાં જ મલ્લિકાએ એક ઈન્ટરવ્યુમાં પોતાની વ્યથા શેર કરી છે. મલ્લિકાએ કહ્યું કે જ્યારે મેં મર્ડરમાં બોલ્ડ સીન્સ આપ્યા હતા ત્યારે લોકોએ મારી નૈતિક રીતે લગભગ હત્યા કરી દીધી હતી. હું એક ખરાબ મહિલા તરીકે જોવામાં આવી હતી. આજે મેં જે બધા દ્રશ્યો આપ્યાં છે તે ફિલ્મોમાં સામાન્ય બની ગયા છે. સમય જતાં, કલાકારો પ્રત્યે લોકોનો અભિગમ બદલાયો છે અને તેમ જ આપણું સિનેમા પણ બદલાઈ ગયું છે. '50 અને 60 ના દાયકામાં બનેલી ફિલ્મ્સની પ્રશંસા કરતાં મલ્લિકાએ કહ્યું, 'તે સમયે મહિલાઓ માટે ખૂબ સારા પાત્રો લખવામાં આવતાં હતાં, પરંતુ આપણી ફિલ્મોમાં કોઈ સુંદરતા વધી નથી. હું વર્ષો સુધી સારા પાત્રની રાહ જોતી રહી. તમને જણાવી દઈએ કે, મલ્લિકા શેરાવતે વર્ષ 2003 માં ફિલ્મ 'ખ્વાહિશ' થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. તે પછી તે 2004 માં ફિલ્મ 'મર્ડર' માં દેખાઈ હતી.



PayLessTravel
Fly Well ... Pay Less

વિમાની સેવાના બુકીંગ માટે એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ



Call for all your Air Travel Services

- Lowest Prices for Ahmedabad, Vadodara, Mumbai, Delhi
- We will beat or match any online price with better service, call once before booking online
- Best Service
- We sell Travel Insurance

Call us for the Lowest Fares Coming From India to Canada Also

Please Call 905-281-2627

Address : 100 Matheson Blvd. East, Unit-203, Mississauga, ON. L4Z 2G7

Get Updated travel information during COVID time



Tico # 50015262
tico.ca
Travel Industry Council of Ontario

GRAND CENTRAL MIMICO
(South Tower)

Guaranteed Access to this prestigious project.

Located at Royal York Rd & Evans Ave in Etobicoke! Grand Central Mimico will feature direct access to the Mimico GO Station,


Starting from **\$500's**

Nadir Shah MBA
Sales Representative

416.625.3580
nadir.shah@sympatico.ca

CENTURY 21
Regal Realty Inc. Brokerage
Member Broker

4030, Sheppard Ave. East, Toronto,
ON M1S 1S6 T: 416.291.0929 (24/7)
F: 416.291.0984



Not intended to solicit buyers or sellers already under a contract



હવે, સ્વદેશ વેબસાઈટના બદલાતા કલેવર

નિહાળો નીત નવા રૂપરંગમાં !!

માત્ર ગરવી ગુજરાત કે મેરા ભારત મહાન જ નહિ પરંતુ સમગ્ર વિશ્વની અટારીએ સર્જાતી અનેકવિધ ઘટનાઓનો સાક્ષાત્કાર શાણેશાણ માણો !!

રાજકારણ, સમાજ, ધર્મ, શિક્ષણ, રમતગમત, મનોરંજનનો મહાસાગર, હોલીવુડ-બોલીવુડ, પ્રવાસ-પર્યટન, પર્યાવરણ તથા આરોગ્ય વિષયક માહિતીના રોમાંચક ખજાનાનો આવિષ્કાર !!

www.swadesh.news

સ્વદેશમાં વિજ્ઞાપનો માટે ઈમેલ એડ્રેસ પર માહિતી મોકલો

info@swadesh.news

હવે પછી નીચે મુજબના સરનામે તમામ પોસ્ટલ વ્યવહાર કરવા વિનંતી.

23 Lyric Road, Brampton ON L6S 0B4.

બિટકોઈન સ્વીકારવા મસ્કનો ઈન્કાર અને ચીનમાં પ્રતિબંધથી વચ્ચુંઅલ કરન્સીને ફટકો

ફિટો કરન્સીમાં ઉથલપાથલથી રોકાણકારોમાં ઉચાટ

બિટકોઈન, ઈથેરિયમ સહિતની ફિટો કરન્સીમાં તાજેતરમાં બોલાયેલા કડાકો દુનિયાના લાખો કરોડો લોકો માટે ચિંતાનો વિષય છે. હાલમાં આ કરન્સીની સપાટી અનેક મહિનાના નીચલા સ્તરે છે. ભૂતકાળમાં ક્યારેક ફિટો કરન્સીના ભાવમાં એક જ દિવસમાં 40થી 50 ટકાનો કડાકો બોલાયો હતો. તેથી રોકાણકારો આ કરન્સીમાં મોટો ફાયદો જોતા રહ્યા છે. જો કે, હાલમાં ફિટો બજારમાં બોલેલા કડાકાએ રોકાણકારોને પરેશાન કરી દીધાં છે. બિટકોઈન, ઈથેરિયમ સહિતની ફિટો કરન્સી તૂટીને છેલ્લા ઘણાં મહિનાના ન્યૂનતમ સ્તરે પહોંચી ગઈ છે. દુનિયાની સૌથી મોટી ફિટો કરન્સી બિટકોઈન ગત બુધવારે આશરે ૩૦ ટકા તૂટી ગઈ હતી. 2021ના એપ્રિલથી લઈને મે મહિનાની 25મી સુધીમાં બિટકોઈનના ભાવ અડધા થઈ ગયા છે. આ જ સમયગાળો એટલે કે છેલ્લાં દોઢ મહિનામાં બીજી ફિટો કરન્સી ડોજકોઈનમાં ૪૫ ટકા અને ઈથેરિયમમાં ૪૦ ટકાનો કડાકો નોંધવામાં આવ્યો છે. ટેસ્લા કંપનીના માલિક ઈલોન મસ્કે બિટકોઈન સ્વીકારવા ઈન્કાર કર્યા બાદ જ બિટકોઈન તૂટવાની શરૂઆત થઈ હતી. આ સાથે જ ચીને ફિટો કરન્સી ઉપર પ્રતિબંધ મૂકવાના નિર્ણયને જાહેર કર્યો હતો. આખરે તેની સીધી અસર ફિટો માર્કેટ પર દેખાઈ રહી છે. આ પહેલા 2021ના ફેબ્રુઆરી માસમાં ઈલોન મસ્કે બિટકોઈનમાં રોકાણ કર્યાની જાહેરાત કરી તે સમયે આ વચ્ચુંઅલ કરન્સીના ભાવમાં જબરદસ્ત ઉછાળો આવી ગયો હતો. રોકાણકારોમાં બિટકોઈન સહિતની વચ્ચુંઅલ કરન્સીનું વચ્ચુંઅલ વધવા માંડ્યું હતું.

કોરોના મહામારીના આ અનિશ્ચિતતા ભર્યા સમયમાં પૈસા સલામત રાખવાના એક ઉપાય તરીકે બિટકોઈન તેમજ અન્ય ફિટો કરન્સીની બોલબાલા વધી છે. છેલ્લા ઘણાં સમયથી બિટકોઈન તેમજ અન્ય ફિટોકરન્સી વિશે સાંભળવા મળે છે. બિટકોઈન તેમજ એના જેવી અન્ય ફિટોકરન્સી વચ્ચુંઅલ કરન્સી એટલે કે આભાસી ચલણ કહેવાય છે. આનો અર્થ એ કે જેમ રૂપિયા કે ડોલરની નોટ અને સિક્કા હોય એવું બિટકોઈનમાં નથી. રૂપિયાની કિંમતનો આધાર આપણી અર્થવ્યવસ્થા પર છે અને ડોલરની કિંમતનો આધાર અમેરિકાની અર્થવ્યવસ્થા ઉપર છે. બિટકોઈનનો આવો કોઈ આધાર નથી. મતલબ કે, દુનિયાની કોઈ સરકાર કે બેંક આ ચલણનું નિયમન કરતી નથી. બિટકોઈનની કિંમતમાં વધઘટ થાય છે તેનો આધાર સહાબાજી પર રહેલો છે. બિટકોઈનનો ઈતિહાસ બહુ જૂનો નથી. ૧૮ ઓગસ્ટ, ૨૦૦૮ના રોજ બિટકોઈનના નામે ડોમેઈન રજિસ્ટર થયું. જાન્યુઆરી ૨૦૦૯માં



સાતોશી નાકામોટો નામના કોઈ અજ્ઞાત વ્યક્તિએ બિટકોઈન સોફ્ટવેર ઓપન સોર્સ તરીકે ઈન્ટરનેટ ઉપર પ્રતિબંધ મૂકવાના નિર્ણયને જાહેર કર્યો હતો. આખરે તેની સીધી અસર ફિટો માર્કેટ પર દેખાઈ રહી છે. આ પહેલા 2021ના ફેબ્રુઆરી માસમાં ઈલોન મસ્કે બિટકોઈનમાં રોકાણ કર્યાની જાહેરાત કરી તે સમયે આ વચ્ચુંઅલ કરન્સીના ભાવમાં જબરદસ્ત ઉછાળો આવી ગયો હતો. રોકાણકારોમાં બિટકોઈન સહિતની વચ્ચુંઅલ કરન્સીનું વચ્ચુંઅલ વધવા માંડ્યું હતું.

બિટકોઈન એક જટિલ કમ્પ્યુટર પ્રક્રિયા દ્વારા તૈયાર થાય છે. જેને બિટકોઈન માર્કેટિંગ કહેવામાં આવે છે. આ કામગીરી કરવા માટે અત્યાધુનિક અને શક્તિશાળી કમ્પ્યુટરની આવશ્યકતા રહે છે. ઉપરાંત માર્કેટિંગ સોફ્ટવેર પણ જરૂરી છે. બિટકોઈન કોઈ એક કમ્પ્યુટરથી તૈયાર થઈ શકતો નથી પરંતુ દુનિયાભરમાં મોજૂદ કમ્પ્યુટર નેટવર્ક દ્વારા તે તૈયાર કરાય છે. દરરોજના સરેરાશ ૩૬૦૦ બિટકોઈન

પ્રાસંગિક
ધવલ શુક્લ

મજાની વાત એ છે કે જેમ જેમ બિટકોઈનમાં ઉછાળાની ખબરો ફેલાય છે તેમ તેમ તેની કિંમતો વધુને વધુ ઊંચે જાય છે. આભાસી ચલણના વધી રહેલા ઉપયોગનું મુખ્ય કારણ એ છે કે, તેના દ્વારા થતી લેવડદેવડ અંગે તપાસ કરવી મુશ્કેલ છે.

બિટકોઈનનું સમર્થન કરતા લોકોની દલીલ છે કે, આંતરરાષ્ટ્રીય સ્તરે પૈસાના ટ્રાન્સફર માટે તે ખૂબ સચોટ અને ઝડપી ઉપાય છે. જો કે, આવા આભાસી ચલણનો વિરોધ કરતા લોકોનું કહેવું છે કે, તેના દ્વારા ડ્રગ્સ અને હથિયારો જેવા ગેરકાયદેસર ધંધાઓને મોકળો માર્ગ મળી જશે.

થોડા વખત પહેલા જ અમેરિકામાં ડ્રગ્સ વેચતી એક કંપની બંધ કરી દેવામાં આવી હતી. આ કંપની તેના માલનું વેચાણ બિટકોઈન મારફત કરતી હતી.

ફિટો કરન્સીના ફાયદા તેટલા જ જોખમ પણ છે. તેના પર કોઈનું નિયંત્રણ ન હોવાથી ગમે તે સમયે વધઘટ સંભવ છે : દોઢ મહિનામાં જ બિટકોઈનના ભાવ અડધા થઈ ગયા

તૈયાર કરવામાં આવે છે. આભાસી એડ્રેસ ઉપર જ બિટકોઈનનું ખરીદ-વેચાણ થાય છે. બીજું એ કે બિટકોઈનની સંખ્યા અને સપ્લાય મર્યાદિત છે. જેના કારણે તેની કિંમતોમાં ભારે ઉછાળો જોવા મળે છે. બિટકોઈન રચાયેલા બાદ તેની કિંમતમાં અનેક ગણો ઉછાળો આવ્યો છે. એક અંદાજ પ્રમાણે હજારો ભારતીયોએ પણ બિટકોઈનમાં રોકાણ કર્યું

અમેરિકાની નાણાકીય સંસ્થાઓ અને એફબીઆઈ જેવી એજન્સીઓ પણ બિટકોઈન દ્વારા ગેરકાનૂની કામો વધવાની ચેતવણી આપી ચૂકી છે. ચીન ઉપરાંત જર્મની અને ફ્રાન્સ જેવા યુરોપી દેશો પણ લોકોને ચેતવણી આપી ચૂક્યાં છે કે, આભાસી નાણું જોખમ ભરેલી અંધકારમય દુનિયા છે.

બિટકોઈનના વધી રહેલા ચલણ સામે ચેતવણી

છતાં તેના સમર્થકોની સંખ્યા વધી રહી છે. કેટલાક લોકો તો બિટકોઈનને ડિજિટલ ગોલ્ડ પણ કહે છે. રશિયા તો આવી ફિટો કરન્સીમાં ભારે રસ લઈ રહ્યું છે. આભાસી ચલણની દુનિયામાં બિટકોઈન એકલું જ નથી. ઈથેરિયમ અને રિપલ જેવી વચ્ચુંઅલ કરન્સી પણ મેદાનમાં છે. હાલ માર્કેટ કેપિટલાઈઝેશનના મામલે ૧૬૨.૫ અબજ ડોલર સાથે બિટકોઈન સૌથી ટોચે રહેલી ફિટો કરન્સી છે. એ પછી ૨૫ અબજ ડોલર સાથે ઈથેરિયમ બીજા સ્થાને અને ૧૦ અબજ ડોલર સાથે એક્સઆરપી રિપલ ત્રીજા સ્થાને છે. તો બિટકોઈન કેશ ૬ અબજ ડોલરની માર્કેટ કેપ સાથે ચોથા સ્થાને છે. ૪.૬ અબજની માર્કેટ કેપ સાથે ટીથર પાંચમા સ્થાને અને ૪ અબજની માર્કેટ કેપ સાથે બિટકોઈન એસવી છઠ્ઠા સ્થાને છે. કિંમતની દૃષ્ટિએ પણ બિટકોઈન ટોચના સ્થાને છે. એક બિટકોઈનની કિંમત આજે અંદાજે ૮૮૦૩ ડોલર આસપાસ છે. તો ઈથેરિયમની કિંમત ૨૨૮ ડોલર આસપાસ અને બિટકોઈન કેશની કિંમત ૩૩૧ ડોલર તેમજ બિટકોઈન એસવીની કિંમત ૨૩૫ ડોલર છે.

ફિટોકરન્સીના ફાયદા પણ ઘણાં છે જેમકે એ ડિજિટલ કરન્સી હોવાથી છેતરપિંડીની શક્યતા ઓછી છે. ફિટોકરન્સીમાં રિટર્ન એટલે કે નફો પણ ઘણો વધારે થાય છે. ઓનલાઈન ખરીદીના કારણે લેવડદેવડ આસાન હોય છે. ફિટોકરન્સી માટે કોઈ નિયામક સંસ્થા ન હોવાથી નોટબંધી કે કરન્સી અવમૂલ્યન જેવી સ્થિતિમાં પણ તેને આંચ આવતી નથી. જો કે, ફિટોકરન્સીમાં જે ઉથલપાથલ જોવા મળે છે એ હદયના ધબકારા વધારી દેવા માટે પૂરતી છે. છેલ્લા પાંચ વર્ષમાં એવું અનેક વખત બન્યું કે બિટકોઈનની કિંમતમાં એક જ દિવસમાં ૪૦થી ૫૦ ટકાનો કડાકો બોલ્યો હોય.

હાલ તો બિટકોઈન ઈન્ટરનેટની દુનિયા સિવાય ચલણમાં નથી. ડિજિટલ ટ્રાન્ઝેક્શન વધતા અને ઈ-કોમર્સની ક્ષિતિજો વિસ્તરતા આવા આભાસી ચલણનો વપરાશ વધવાની શક્યતાઓ નિષ્ણાંતો જોઈ રહ્યાં છે. ઘણાં લોકો વચ્ચુંઅલ કરન્સીની વધી રહેલી કિંમતો જોતા તેમાં રોકાણ કરવા પણ લલચાય એ સ્વાભાવિક છે. પરંતુ તેમાં રોકાણ કરવું જોખમભર્યું તો છે જ એ ફરી વખત સાબિત થયું છે. આજે પણ દુનિયાના લાખો રોકાણકારોના જીવ અધ્ધર થયા છે કારણ કે વચ્ચુંઅલ કરન્સીની ચમક ઘટી રહી છે. જે લોકોને બિટકોઈનમાં સોનાની ખાણ દેખાઈ રહી છે એવા લોકો માટે આ ચેતી જવાનો સંકેત છે. એવું પણ બને કે વખત જતાં આ આભાસી ચલણ ઈન્ટરનેટની આભાસી દુનિયામાંથી પણ અદૃશ્ય બની જાય.



SHARP
INTERNATIONAL
IMMIGRATION SERVICES



CANADA IMMIGRATION

GOOD NEWS FOR RECENTLY GRADUATED STUDENTS INSIDE CANADA

**STUDENTS UNDER POST GRADUATION WORK
PERMIT WITH IELTS 5 BAND CAN QUALIFIED
TO APPLY FOR PERMANENT RESIDENCY
RIGHT AWAY !!**

Effective May 6, 2021, Immigration, Refugees and Citizenship Canada (IRCC) will begin accepting applications under the following 3 streams:

20,000

applications for temporary workers in health care

30,000

applications for temporary workers in other selected essential occupations

40,000

applications for international students who graduated from a Canadian institution

**FIRST COME FIRST
SERVE BASIS !!**

CONTACT US IMMEDIATELY

**SUPER VISA INSURANCE / TRAVEL INSURANCE
/ PR 90 DAYS INSURANCE**

94- 499 MAIN STREET SOUTH, SHOPPERS
WORLD MALL, BRAMPTON, ONT

**416-745-2466
905-230-7855**

2/A WAGHESHWARI SOC,
VADODARA GUJARAT INDIA

**91-9428973911
91-9512157817**

Email.: info@siis.ca

Website.: www.siis.ca

AMI MEHTA
IMMIGRATION PRACTITIONER

**BUSINESS IMMIGRATION
TO CANADA REQUIRES
3 CR NET WORTH/
1.5 CR INVESTMENT/
BUSINESS OWNERSHIP/
MANAGEMENT EXP**

**REJECTED
CASES WELCOME**

**ONLINE IELTS
SPOKEN ENGLISH
CLASSES ON ZOOM**



બ્લેક નહીં, વ્હાઇટ હેડ્સની સમસ્યાથી પરેશાન છો, તો અપનાવો આ ઉપાય



તમે બ્લેક હેડ્સ અંગે તો ઘણી વખત સાંભળ્યું હશે. જે રીતે ચહેરા પર બ્લેક હેડ્સ થાય છે તે જ રીતે અણગમતા વ્હાઇટ હેડ્સ પણ થાય છે. ચહેરાના કોઈપણ ભાગ જે વધારે ઓછા હોય છે જેમ કે, નાક અને દાઢી પર વ્હાઇટ હેડ્સ થાય છે. કેટલાક લોકો તેને હાથથી દબાવીને નીકાળવાની કોશિશ કરે છે. પરંતુ જ્યારે તે વધારે અંદર હોય છે તો હાથથી નીકળી શકતા નથી. એવામાં અમે તમને કેટલાક ઘરેલું ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ. જેને તમે અજમાવી શકો છો.

ચંદન સ્ક્રબ

એક ચમચી ચંદન પાવડર લો. તેમા થોડુંક લીંબુ અને બે ચમચી ગુલાબજળ ઉમેરીને પેસ્ટ તૈયાર કરી લો. હવે તેને 15-20 મિનિટ સુધી ચહેરા પર લગાવો અને ચહેરાને બરાબર ધોઈ લો.

ચણાની દાળનો સ્ક્રબ

એક ચમચી ચણાની દાળને પીસીને તેમા 1 ચમચી કાચુ દૂધ અને બે ચમચી ગુલાબજળ મિક્સ કરી લો. હવે આ પેસ્ટને ચહેરા પર 20 મિનિટ લગાવીને રાખો. તે બાદ ચહેરાને ધોઈ લો. જેથી થોડાક દિવસમાં વ્હાઇટ હેડ્સની સમસ્યા દૂર થઈ શકે છે અને ચહેરા પર પર રોનક આવી શકે છે.

મેથી

એક મુઠ્ઠી મેથીને પીસીને તેની પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટને ચહેરા પર 15-20 મિનિટ સુધી લગાવી રાખો અને બાદમાં હળવા ગરમ પાણીથી ચહેરાને રગડીને ધોઈ લો. જેથી વ્હાઇટ હેડ્સની સમસ્યા ગાયબ થશે.

બદામ અને દૂધ

5-6 બદામને પીસીને તેમા બે ચમચી દૂધ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરી લો અને થોડીક વખત ચહેરા પર લગાવી રાખો. સૂકાઈ ગયા બાદ હળવા હાથથી રગડીને ચહેરાને બરાબર ધોઈ લો. તેનાથી વ્હાઇટ હેડ્સ નીકળવાની સાથે જ ત્વચા પણ ચમકદાર બનશે. આ ઉપાય અઠવાડિયામાં 1-2 વખત કરી શકો છો.

એર ઈન્ડિયા પણ સાયબર એટેકનો ભોગ



ભારતીય એર ઈન્ડિયા કંપનીના ડેટાની સુરક્ષા કરતી કંપની SITA સાયબર એટેકનો ભોગ બની છે જેના કારણે છેલ્લા 10 વર્ષનો ડેટા લીક થયો છે. જેમાં 45 લાખ લોકોના ડેટા લીક થયા હોવાનું જણાવે છે. આ સાયબર એટેક SITA ના PSS (પેસેન્જર સર્વિસ સીસ્ટમ) માં થયો હોવાથી એર ઈન્ડિયાના મોટા ભાગના ગ્રાહકોના ડેટાને હાની થઈ હતી.

આ ડેટા લીકમાં 26 ઓગસ્ટ, 2011 થી 3 ફેબ્રુઆરી, 2021 વચ્ચે નોંધાયેલા ગ્રાહકોના અંગત ડેટા સામેલ છે. જેમાં પૂરું નામ, જન્મ તારીખ, કોન્ટેક્ટ ડીટેલ, પાસપોર્ટની માહિતી, ક્રેડિટકાર્ડની માહિતી વગેરે. પરંતુ એર ઈન્ડિયા જણાવે છે કે ક્રેડિટ કાર્ડ સાથે સંકળાયેલા સીવીવી / સીવીસી નંબરો કે પાસવર્ડ્સને અસર થઈ નથી. ડેટા બ્રીચ 19 માર્ચ, 2021માં થયા હોવાનું જણાય છે. આ માહિતી જાહેર જાણને જાણ થઈ એક સાયબર એક્સપર્ટ છે તે પોતાના ટ્વીટર એકાઉન્ટ દ્વારા 21 મે, 2021 એ ટવીટ કરી જણાવે છે.

માર્ચમાં સ્વિસ એવિએશન ઈન્ફર્મેશન

ટેકનોલોજી કંપની SITA એ જાહેર કર્યું હતું કે એટલાન્ટા સ્થિત તેના સર્વિસ પર ખૂબ જ અત્યાધુનિક હુમલો થયો છે, જેના કારણે PSS માં રહેલા ગ્રાહકોના ડેટાને નુકશાન થયું છે. SITA PSSને વારંવાર અપડેટ કરવામાં આવે છે. જેથી ગ્રાહકની લાઈવ માહિતી મળી રહે.

એર ઈન્ડિયા સાથે વિકાસ માટે ઘણી કંપની જોડાય છે. જેમાં એર ન્યુઝીલેન્ડ, લુક્સાન્સા, સિંગાપોર એરલાઈન્સ, મલેશિયા એરલાઈન્સ, કેથે પેસિફિક, સ્કેન્ડિનેવિયન એરલાઈન્સ, સાઉથ કોરિયાની જેજુ એર, અમેરિકન એરલાઈન્સ અને યુનાઈટેડ એરલાઈન્સની લાંબી સૂચી છે. એર ઈન્ડિયાની જેમ આ એરલાઈન્સને પણ ડેટા લીકનો ખતરો છે.

વધુમાં એર ઈન્ડિયા જણાવે છે કે તે તેના સાયબર નિષ્ણાતો સાથે સતત ડેટા લીકની માહિતી લે છે. વધુમાં તે જણાવે છે કે ગ્રાહકોએ ફ્લાયર પ્રોગ્રામના પાસવર્ડ્સ બદલવા જોઈએ અને ક્રેડિટકાર્ડની માહિતી પોતાના એકાઉન્ટમાંથી કાઢી નાખવી જોઈએ.

@beinghumanmj

કથા, હવન, ગાયત્રી યજ્ઞ,
વાસ્તુ પૂજન, શ્રાદ્ધ શાંતિ,

જીટીએમાં દરેક જગ્યાએ
અમો સેવા આપીએ છીએ.

શશીકાંત ભટ્ટ

૯૦૫ ૪૫૬ ૭૬૨૨



કાલસર્પે યોગ શાંતિ, નક્ષત્ર શાંતિ,
વગેરે ધાર્મિક કાર્યો અને લગ્ન,
બેબી શાવર, જેવા કાર્યો માટે
સંપર્ક કરો.

Shashikant Bhatt

Home: 905-456-7622

Cell: 416-258-2750

LIFE INSURANCE
MORTGAGE/LINE OF CREDIT INSURANCE

Q : DO YOU HAVE MORTGAGE / LINE OF CREDIT INSURANCE WITH BANK ?
A : COMPARE & SAVE UP TO 50% LOWEST RATES GUARANTEED

AGE	\$ 250,000		\$500,000		\$1000,000	
	Male	Female	Male	Female	Male	Female
30 Yrs	\$ 12.00	\$ 07.00	\$ 18.00	\$ 10.00	\$ 32.00	\$ 19.00
40 Yrs	\$ 13.00	\$ 08.00	\$ 22.00	\$ 14.00	\$ 36.00	\$ 26.00
50 Yrs	\$ 30.00	\$ 18.00	\$ 50.00	\$ 31.00	\$ 95.00	\$ 60.00
60 Yrs	\$ 85.00	\$ 56.00	\$ 146.00	\$ 103.00	\$ 271.00	\$ 190.00


ALSO AVAILABLE

- NO MEDICAL TEST LIFE INSURANCE (up to age 85)
(Even if you have DIABETES, BLOOD PRESSURE, HEART ATTACK, STROKE)
CANCER OR INSURANCE declined by other companies
- CORPORATION OWNED LIF / CRITICAL ILLNESS INSURANCE
(Key Person INSURANCE, BUY SELL AGREEMENT, GROUP BENEFITS)
- MONEY BACK LIFE / CRITICAL ILLNESS INSURANCE, RRSP, RESP, TFSA

Visitor To CANADA INS, TRAVEL INS, Lite ins For Refugees & Work Permits

416.320.4614 Toll : 1866.623.0865 Call For HONEST ADVICE

SUPER VISA INSURANCE
HARD TO BEAT OUR PREMIUMS


Davinder Singh Chawla



DIVINE YOGA

By Geeta

FREE Special Yoga Class Streaming NOW
due to COVID

- Reduce Stress and Anxiety
- Boost Immunity and Sleep Quality
- Gain Strength and Flexibility
- Become the Best Version of Yourself

The beauty of yoga is that you don't have to be a yogi or yogini to reap the benefits

Join today on ZOOM!

Classes Available: One-to-One Individual, Therapeutic, and Children

GEETA TAILOR : 416-456-2261
Contact Geeta at divineyogabygeeta@gmail.com
IG & FB: @divineyogabygeeta

‘યાસ’ વાવાઝોડાથી 1 કરોડને અસર, 4નાં મોત

21 લાખનું સ્થળાંતર, અનેક જગ્યાએ વીજળી ખોરવાઈ, ઝારખંડ અને બિહારમાં ભારે વરસાદ, હાઈએલ્ટ અપાયું, ઓરિસ્સામાં 10ને બચાવાયા

કોલકાતા

કોલકાતા : પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં ત્રાટકેલા યાસ નામના વાવાઝોડાએ ભારે તારાજ સર્જી હતી. આ વાવાઝોડામાં 145 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. સાથે જ ભારે વરસાદને પગલે કેટલાક ગામો ડુબી ગયા હતા.



યાસ કરીને જે સમુદ્રી વિસ્તારો છે ત્યાં સૌથી વધુ માઠી અસર જોવા મળી હતી. ઝારખંડમાં પણ વાવાઝોડાને પગલે હાઈએલ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. કુલ મળી આશરે ચાર જેટલા લોકોએ આ વાવાઝોડામાં જીવ ગુમાવ્યો છે. જ્યારે અનેક લોકો લાપતા હોવાથી

તેમની શોધખોળ ચાલી રહી છે. વાવાઝોડામાં ભારે પવન અને વરસાદને પગલે ઉભા પાકને ભારે નુકસાન થયું હતું. ઓરિસ્સાના ધર્મા પોર્ટ પર સૌથી પહેલા ગુરુવારે સવારે નવ વાગ્યે વાવાઝોડું ત્રાટક્યું હતું. આશરે 21 લાખ લોકોનું સમુદ્રી કાંઠાના વિસ્તારોમાંથી સુરક્ષીત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જોકે બપોર બાદ વાવાઝોડું નબળુ

પડી ગયું હતું. સૌથી વધુ અસર પશ્ચિમ બંગાળમાં જોવા મળી છે જ્યાં આશરે ત્રણ લાખ જેટલા મકાનોને ભારે નુકસાન પહોંચ્યું છે. અનેક મકાનો જમિનદોસ્ત થયા હતા. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું હતું કે યાસ વાવાઝોડાને કારણે એક કરોડ લોકો પ્રભાવિત થયા છે. જેમાં લાખો લોકોના મકાનો નાશ પામ્યા છે.

હાલ જે પણ વિસ્તારોમાં વાવાઝોડાએ વિનાશ વેર્યો છે ત્યાં રાહતકાર્ય માટે 10 કરોડ રૂપિયાની રાહત સામગ્રી મોકલવામાં આવી છે. સૈન્યની મદદ લેવામાં આવી રહી છે. બંગાળમાં 17 કોલમ તૈનાત કરવામાં

આવી છે. આ ઉપરાંત એનડીઆરએફ, એસડીઆરએફ અને રાજ્યની પોલીસની ટીમને તૈનાત કરવામાં આવી છે. અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે. કોલકાતામાં ઘુંટણ સમા પાણી ભરાઈ ગયા હતા. ઓરિસ્સાના બાલાસોર જિલ્લાના સમુદ્રી કાંઠાના અનેક ગામોમાં પાણી ઘુસી ગયા છે. અહીંની નદીઓમાં પણ ભારે પૂરનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. કેટલાક જિલ્લામાં વીજળી ગુલ થઈ ગઈ છે. વાવાઝોડાની ગતી ધીમી પડતા જ ઝારખંડ તરફ ફંટાયું હતું જોકે ઝારખંડમાં તેની સામાન્ય અસર રહી હતી. પણ ભારે વરસાદ પડ્યો હતો.

દિલ્હીની સરહદો પર ખેડૂત આંદોલનને 6 માસ પૂરા, ફરી વિરોધ તેજ કરશે અગ્રદાતા

સંયુક્ત ખેડૂત મોરચાના નેતાઓના કહેવા મુજબ તેમને ડરાવીને ડગાવી નહીં શકાય

નવી દિલ્હી

દિલ્હીની સરહદોએ વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને બુધવારે 6 મહિના પૂરા થઈ ગયા છે. ત્યારે બુધવારે જ વર્તમાન કેન્દ્ર સરકારને સત્તામાં સતત 7 વર્ષ પૂર્ણ થયા છે. બુદ્ધ પૂર્ણિમાના આ અવસર પર ખેડૂતોએ કેન્દ્ર સરકાર વિરૂદ્ધ પોતાના વિરોધનો સ્વર ફરી તેજ કરવાની જાહેરાત કરી છે. ખેડૂતો આ દિવસને કાળા દિવસ તરીકે ઉજવશે. સંયુક્ત ખેડૂત મોરચાના નેતાઓના

કહેવા પ્રમાણે તેમને ડરાવીને કે થકવીને ડગાવી નહીં શકાય. જ્યાં સુધી સરકાર તેમના વિરૂદ્ધ નોંધાયેલા તમામ કેસ પાછા નહીં ખેંચે અને તેમની માંગણીઓ નહીં સ્વીકારી લે ત્યાં સુધી તેઓ દિલ્હીની સરહદેથી પાછા નહીં જાય. ખેડૂતોએ દિલ્હી સહિત તમામ ધરણા સ્થળોએ બુદ્ધ પૂર્ણિમા પર્વ ઉજવવાની જાહેરાત કરી છે.

ધરણા સ્થળોએ કાળા વાવટા ફરકાવીને અને સરકારના પૂતળા

સળગાવીને વિરોધ કરવાની તૈયારી છે. સંયુક્ત ખેડૂત મોરચાના નેતા બલવીર સિંહ રાજેવાલ, ડૉ. દર્શન પાલ, ગુરુનામ સિંહ ચઢૂની, હનન મૌલા વગેરે નેતાઓના કહેવા પ્રમાણે ખેડૂતો સત્ય અને અહિંસાના બળ પર પોતાનું આંદોલન આગળ વધારી રહ્યા છે. પરંતુ ભાજપની કેન્દ્ર સરકાર અનેક વખત આ આંદોલનને હિંસક સ્વરૂપ આપવા પ્રયત્ન કરતી રહે છે જેમાં તે હંમેશા અસફળ રહી છે.

IMAએ બાબા રામદેવને મોકલી 1,000 કરોડની માનહાનિ નોટિસ

પોતાની દવાઓ વેચવા રામદેવ ટીવીમાં વેક્સિનેશનની સાઈડ ઈફેક્ટ્સની જાહેરાત કરી રહ્યા હોવાનો આરોપ

નવી દિલ્હી

ઈન્ડિયન મેડિકલ અસોસિએશન (IMA) ઉત્તરાખંડે યોગગુરૂ બાબા રામદેવને 1,000 કરોડની માનહાનિ નોટિસ મોકલી છે. આ નોટિસમાં બાબા રામદેવને પોતાના વિવાદિત નિવેદન મુદ્દે સ્પષ્ટતા કરતો વીડિયો જાહેર કરવા અને 15 દિવસમાં IMAની લેખિત માફી માંગવા કહેવામાં આવ્યું છે. સાથે જ આવું નહીં કરવામાં આવે તો 1,000 કરોડનો માનહાનિ કેસ કરવાની ધમકી પણ આપવામાં આવી છે.

નોટિસમાં IMAએ લખ્યું છે કે, બાબા રામદેવ એલોપથીનો ‘એ’ પણ નથી જાણતા, અમે તેમના સવાલોનો જવાબ આપવા તૈયાર છીએ પરંતુ તે પહેલા પોતાની યોગ્યતા તો જણાવે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, જો બાબા 15 દિવસની અંદર માફી નહીં માંગે તો તેમના વિરૂદ્ધ 1,000 કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો કરવામાં આવશે. IMA ઉત્તરાખંડે લખ્યું છે કે, ‘રામદેવ પોતાની દવાઓ વેચવા માટે સતત જુઠાણું ફેલાવી રહ્યા છે.

માસ્ક ન પહેરનારને હાથ-પગમાં પોલીસે ખિલ્લીઓ ધૂસાડી, માતાએ મૂક્યો આરોપ

બરેલી

બરેલીના બારાદરી પોલીસ સ્ટેશન પર ગંભીર પ્રકારના આરોપો લાગ્યા છે. એક મહિલાએ આરોપ લગાવ્યો છે કે માસ્ક નહીં પહેરવાના કારણે પોલીસે તેમના પુત્રના હાથ અને પગમાં ખિલ્લીઓ મારી. આ અંગે ફરિયાદ કરવા તે પોલીસ સ્ટેશન ગઈ ત્યારે તેને તેમને ધમકાવવામાં આવ્યા. મહિલાએ આરોપ લગાવતા કહ્યું કે, ત્રણ સિપાહીઓએ તેમના પુત્રને માસ્ક નહીં પહેરતા ઉઠાવીને લઈ ગયા. જ્યારે તેઓ પોલીસ સ્ટેશન ગયા તો જાણકારી મળી કે તેમના પુત્રને ક્યાંય મોકલી

દેવાયો છે. જ્યારે પરિવારજનોએ તેમના પુત્રની શોધ કરી તો તે ગંભીર હાલતમાં મળ્યો અને તેના હાથ અને પગમાં ખિલ્લીઓ મારેલી હતી. ત્યાં જ પોલીસે આ આરોપો પર ખુલાસો કર્યો છે.

મહિલાનો આરોપ છે કે જ્યારે તેમણે તેમના પુત્રના ઉત્પીડનની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કરી તો તેમનું કોઈએ સાંભળ્યું નહીં. માત્ર આટલું જ નહીં ઉપરથી મહિલા એને પીડિતને જેલમાં ધકેલવાની વાત કહી. આ વાતથી પરેશાન થઈ પીડિતની માતાએ સિનિયર પોલીસ અધિક્ષકનો સંપર્ક સાધ્યો છે. આ મહિલા જોગી નવાડાની રહેવાસી છે.

પુત્રના આ ઉત્પીડન બાદ જોગી ન્યાય માટે ગુહાર લગાવી રહી છે. તેઓ કહે છે કે પુત્રના માસ્ક ન લગાવવા બદલ તેના હાથ અને પગમાં ખિલ્લીઓ મારી દીધી. જોગીએ ત્રણેય સિપાહીઓ પર પુત્ર સાથે અમાનવીય વર્તન કરવાનો આરોપ લગાવ્યો છે. એસએસપી રોહિત સજવાણનું કહેવું છે કે, આ યુવાન પોલીસનો જુનો ગુનેગાર છે. તેના ઉપર અનેક ગંભીર કલમો અંતર્ગત અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયેલા છે. તેમનું કહેવું છે કે આ તમામ આરોપો ટાળવા માટે તે યુવક પોલીસ પર આવા આક્ષેપો કરી રહ્યો છે.

પુલવામા ખાતે શહિદ થયેલા જવાન વિભૂતિ ઢૌડિયાલની પત્ની હવે આર્મીમાં જોડાશે

દહેરાદૂન

પુલવામામાં ૮ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ આંતકીઓને પડકારનારા મેજર જવાન વિભૂતિ ઢૌડિયાલ શહિદ થયા હતા. જે બાદ તેણીએ હિંમત હારી ન હતી. તેણે અલ્લાબાદમાં વુમન એન્ટ્રી સ્કીમની પરીક્ષા પાસ કરીને ચેન્નાઈની ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમીમાં ટ્રેનિંગ લીધી હતી. વિભૂતિ ઢૌડિયાલનું પાર્થિવ શરીર જ્યારે તેમના વતન લાવવામાં આવ્યું ત્યારે નિતિકાએ આઈ લવ યૂ વિભુ કહીને મામિક વિદાય આપી હતી. વિભૂતિના પિતા સ્વ ઓમપ્રકાશ ઢૌડિયાલના ચાર સંતાનોમાં ત્રણ દીકરીઓ એક માત્ર દીકરો હતો. હવે વિભૂતિની પત્ની નિતિકા પણ ટૂંક સમયમાં આર્મીમાં જોડાનાર છે.

રૂપિયા 22,000 કરોડનો આઈપીઓ બજારમાં મુકવા પેટીએમની હિલચાલ

મુંબઈ

દેશની અગ્રણી ડિજિટલ પેમેન્ટ કંપની પેટીએમ આ વર્ષે આઈપીઓ લાવવાની યોજના ઘડી રહી છે. કંપની તે આઈપીઓ મારફતે ૨૧,૯૦૦ કરોડનું ભંડોળ એકઠું કરવાની નેમ ધરાવે છે. જો એલઆઈસી પહેલાં પેટીએમનો આઈપીઓ આવી જશે તો અત્યારસુધીનો સૌથી મોટો આઈપીઓ બની રહેશે. જાણકાર સૂત્રોના જણાવ્યા મુજબ પેટીએમના રોકાણકારોમાં બાર્કશાયર હેથવે, સોફ્ટ બેન્ક જૂથ અને એન્ટ ગ્રૂપનો સમાવેશ થાય છે. તે તમામ મોટા રોકાણકારો છે.

બાર્કશાયર વિશ્વના શેરબજારોના સૌથી મોટા રોકાણકાર વોરન બફેટની કંપની છે તે સોફ્ટબેન્ક જાપાની કંપની છે. એન્ટ ગ્રૂપ ચીનના અલીબાબા ગ્રૂપની કંપની છે. તે તમામ રોકાણકારો પેટીએમને આ જ વર્ષે નવેમ્બર સુધીમાં લિસ્ટ કરાવવાની યોજના ધરાવે છે. દિવાળી સુધીમાં આ કંપની શેરબજારમાં આવી શકે છે. પેટીએમ વન૯૭ કોમ્યુનિકેશન હેલ્થ છે. તેનું મૂલ્ય રથી ૨.૨૦ લાખ કરોડ રૂપિયાનું મૂલ્ય ધરાવે છે. આઈપીઓમાં પહેલાના અર્થાત જૂના અને નવા એમ બંને શેર જારી થશે.

ટ્વિટરની હરીફ ભારતીય કંપની કૂએ રૂપિયા 218 કરોડ એકત્ર કર્યા

નવી દિલ્હી

ટ્વિટરની હરીફ ભારતીય કંપની કૂએ 218 કરોડ રૂપિયાનું રોકાણ એકત્ર કર્યું છે તેમ કંપની દ્વારા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે. ૩ કરોડ ડોલરમાં ટાઈગર ગ્લોબલ પણ રોકાણ કર્યું છે. કૂ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં ૩ કરોડ ડોલરના રોકાણમાં ટાઈગર ગ્લોબલ ઉપરાંત કંપનીના વર્તમાન રોકાણકારો એકસેલ પાર્ટનર, કલારી કેપિટલ, શ્રીવનફોર કેપિટલ, બ્લૂમ વેનચર્સ અને ડ્રીમ ઈન્ક્યુબેટરનું રોકાણ પણ સામેલ છે. આઈઆઈએફએલ અને મિરાઈ એસ્ટેટ્સ કૂના નવા રોકાણકારો બન્યા છે. ભારતીય કંપની કૂના હાલમાં 60 લાખ વપરાશકારો છે.



ફાઈઝર 4 મહિનામાં ભારતને 5 કરોડ ડોઝ આપશે

મોસ્કો

દરમિયાન દેશમાં વેક્સિનની અછતના અહેવાલો વચ્ચે એક રાહતના સમાચાર છે. ફાઈઝર બેઠકમાં કેન્દ્રને જણાવ્યું હતું કે તેની વેક્સિન ૧૨ વર્ષથી ઉપરના તમામ લોકો માટે સુરક્ષિત અને એકદમ અસરકારક છે. તેણે દાવો કર્યો છે કે આ વેક્સિન ભારતમાં સૌપ્રથમ મળેલા કોરોના સ્ટ્રેન સામે પણ ઘણી અસરકારક છે. આ વેક્સિનને ૨-૮ ડિગ્રી તાપમાનમાં એક મહિના માટે સ્ટોર પણ કરી શકાય છે. અમેરિકન દવા કંપની ફાઈઝર હવે ભારતને તેની વેક્સિન આપવા તૈયાર થયું હોવાના અહેવાલો છે. તે જુલાઈથી ઓક્ટોબર દરમિયાન ભારતને પાંચ કરોડ ડોઝ આપવા તૈયાર છે. જો કે આના માટે તેણે સરકાર સમક્ષ પોતાને થયેલાં નુકસાનને ભરપાઈ કરી આપવાની શરત મૂકી હોવાના અહેવાલો છે. સૂત્રો અનુસાર કેન્દ્ર અને ફાઈઝરના ચેરમેન આલ્બર્ટ બુર્લા વચ્ચેની બેઠક બાદ ભારતમાં કોરોના વેક્સિનની મંજૂરીમાં ઝડપ લાવવા ત્રણ મહત્ત્વના મુદ્દે સહમત થયા હતા.

વિશ્વમાં કોરોના રસીની ભારે ખેંચ વચ્ચે હોંગકોંગ લાખો ડોઝ કચરામાં ફેંકી દેશે

હોંગકોંગ : ભારત સહિત એવા કેટલાય દેશ છે કે જ્યાં કોરોના રસીની અછત છે. આફ્રિકાના કેટલાય દેશોમાં તો રસી માટે ભૂમરાણ મચી છે ત્યારે આપણો જ એક પડોશી દેશ રસીના લાખો ડોઝ કચરા ટોપલીમાં ફેંકવાની તૈયારીમાં છે કારણ કે રસીની એક્સપાયરી ડેટ નજીક આવી ગઈ છે. અધિકારીઓએ મંગળવારે કહ્યું કે રસી લેવા માટે પૂરતી સંખ્યામાં લોકો રજિસ્ટ્રેશન કરાવી રહ્યા નથી. આથી પરિસ્થિતિ એવી બની રહી છે કે હોંગકોંગ

એવા ગણ્યા ગાંઠ્યા દેશોમાં સ્થાન પામ્યું છે કે જ્યાં જરૂરિયાત કરતાં વધુ રસી ઉપલબ્ધ છે. અહીંની વસ્તી લગભગ 75 લાખ છે. ઓનલાઈન થઈ રહેલા દુષ્પ્રચાર અને શહેરને વાયરસ મુક્ત કરવાની સરકારી કોશિશ ઓછી પડવાથી લોકો રસી લેતાં અચકાઈ રહ્યા છે. સરકારી વેક્સિન ટાસ્ક ફોર્સના એક સભ્યે ચેતવણી આપી કે એમની પાસેનો રસીનો જથ્થો આગામી ત્રણ માસ સુધી જ સુરક્ષિત રહી શકશે. એ પછી આ રસીનો જથ્થો ખરાબ થઈ જશે.

ભારતીય રસીએ કોરોનાથી બચવામાં વિશ્વને મોટી મદદ પૂરી પાડી : પીટર હોટેજ

હ્યુસ્ટન : વિશ્વમાં કોરોના વાયરસનો ફેલાવો રોકવામાં ભારતની રસી અત્યંત ઉપયોગી નીવડી છે. હ્યુસ્ટનની બાયલોર કોલેજ ઓફ મેડિસીન સ્થિત નેશનલ સ્કૂલ ઓફ ટ્રોપિકલ મેડિસીનના ડીન ડો.પીટર હોટેજે એક વેબિનારમાં જણાવ્યું કે દુનિયામાં કોરોના વાયરસની આગેકૂચને અટકાવવામાં ભારતની કોરોના રસી ખૂબ અગત્યની પૂરવાર થઈ છે. આંતરરાષ્ટ્રીય કક્ષાના વૈજ્ઞાનિક ડો. હોટેજે કહ્યું કે ભારતે વૈશ્વિક સંસ્થાનો સાથે મળીને તૈયાર કરેલી કોરોના રસીએ વિશ્વને કોરોના રોકવામાં નોંધપાત્ર મદદ કરી છે.

અમેરિકાના સાન જોસ ખાતે ગોળીબારમાં 8 લોકોના મોત, શકમંદ પણ માર્યો ગયો

વોશિંગ્ટન

અમેરિકાના સાન જોસ ખાતે આવેલા રેલ યાર્ડમાં બુધવારે ગોળીબારની ઘટના બની હતી જેમાં 8 લોકોના મોત થયા હતા. સાંતા ક્લારા કાઉન્ટીના શેરિફના પ્રવક્તાએ જણાવ્યું કે, બુધવારે વેલી ટ્રાન્સપોર્ટેશન ઓથોરિટી લાઈટ રેલ યાર્ડ ખાતે થયેલા ગોળીબારમાં શકમંદ પણ માર્યો ગયો હતો.

સિલ્વિકોન વેલી ખાતે આવેલા રેલ યાર્ડમાં બુધવારે ગોળીબાર થયો હતો જેમાં અનેક લોકો માર્યા ગયા હતા અને ઘાયલ થયા હતા તથા શકમંદ પણ મૃત્યુ પામ્યો હતો. સાંતા ક્લારા કાઉન્ટીના શેરિફ વિભાગને અહીં આવેલા રેલ કેન્દ્ર ખાતે ગોળીબારની ઘટના બની હતી. તે એક પરિવહન નિયંત્રણ કેન્દ્ર છે જ્યાં ટ્રેન પાર્ક થાય છે અને એક મેઈન્ટેનન્સ યાર્ડ પણ છે. પીડિતોમાં વેલી ટ્રાન્સપોર્ટેશન ઓથોરિટી



(વીટીએ)ના કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. વીટીએ સાંતા ક્લારા કાઉન્ટીમાં બસ, લાઈટ રેલ અને અન્ય પરિવહન સેવાઓ ઉપલબ્ધ કરાવે છે. સાન જોસના મેયર ટ્વીટ કરીને મૃતકોના પરિવાર પ્રત્યે હમદર્દી દર્શાવી હતી.

એમેઝોન હોલિવુડનો એમજીએમ રૂપિયા 60,000 કરોડમાં ખરીદશે

• ઓટીટી પ્લેટફોર્મ પર હોલિવુડની સુપરહીટ ફિલ્મો બતાવવા માટે એમેઝોને એમજીએમ સાથે મર્જર કર્યું કેલિફોર્નિયા

કોરોના સંક્રમણ કાળમાં, વિશ્વની બે મોટી મનોરંજન કંપનીઓ વચ્ચેનાં સોદાની પુષ્ટિ થઈ ગઈ છે. જેમ્સ બોન્ડ ફિલ્મો માટે છેલ્લી ચાર પેઢી સુધીનાં સિનેમેટોગ્રાફરોનાં હૃદયની નજીક રહેલી કંપની, એમજીએમ હવે એમેઝોનની થઈ જશે. આ સોદો 8.45 અબજ ડોલર (અંદાજે રૂ. 60,000

કરોડ)માં થયો હોવાનું કહેવાય છે. આ સોદો નિયમનકારી સંસ્થાઓની મંજૂરી સાથે જ અમલમાં આવશે. એમજીએમ સ્ટુડિયોની સ્થાપના માર્કસ લો અને લુઈસ બી મેયર દ્વારા 17 એપ્રિલ 1924 ના રોજ કરવામાં આવી હતી. અમેરિકામાં બુધવારે સવારે આ અંગેની માહિતી જાહેર થઈ, મહિનાઓ અને અઠવાડિયાઓ સુધી ચાલેલી અટકળો પછી, હવે સ્પષ્ટ થઈ ગયું છે કે એમેઝોન કંપની આ ગૌરવપૂર્ણ પરંપરા ધરાવતા હોલિવુડ સ્ટુડિયો એમજીએમને પોણા નવ અબજ ડોલરમાં ખરીદવા જઈ રહી છે.

USમાં બિલ ગેટ્સની ધરપકડ કરવા માટે પ્રબળ બનતી માંગ

• છૂટાછેડાની જાહેરાત પછી બિલ ગેટ્સની મુશ્કેલીમાં વધારો થવાની આશંકા

વોશિંગ્ટન

એક સમયે સોફ્ટવેર ઉદ્યોગના બેતાજ બાદશાહ મનાતા બિલ ગેટ્સ સામે મુશ્કેલીઓ એકસામટી આવી છે. મેલિન્ડા ગેટ્સે છૂટાછેડા લેવાની જાહેરાત કર્યા બાદ બિલગેટ્સના ભૂતકાળની ઘણી અજાણી બાબતો પ્રકાશમાં આવી રહી છે. હાલ કોન્સપિરસી થિયરિસ્ટો અને રસીવિરોધીઓ માટે બિલ ગેટ્સ ફેવરિટ હિપિંગ બોય છે. દુનિયામાં બિલ ગેટ્સ ફાઈવ જી ટેકનોલોજી દ્વારા

લોકોના જીવનને નિયંત્રિત કરવા માંગે છે અને કોરોના મહામારી એ તેનું વસ્તી ઘટાડવા માટેનું કાવતરૂ છે અને તેની ધરપકડ કરવી જોઈએ એ પ્રકારની રોજ અસંખ્ય કોન્સપિરસી પોસ્ટ સોશયલ મિડિયા પર ફરે છે.

હાલ દુનિયામાં બિલ ગેટ્સના વિરોધીઓની સંખ્યામાં ભારે ઉછાળો આવ્યો છે. ભવિષ્યમાં બિલ ગેટ્સ કેટલો મહાન ગણાશે તે એક સવાલ છે. વોલ સ્ટ્રીટ જર્નલે તેના એક અહેવાલમાં જણાવ્યું છે કે માર્કેટિંગ કંપનીની એક મહિલા એનિનિયરે દાવો કર્યો છે કે તેને ગેટ્સ સાથે 2000ની સાલથી વર્ષો સુધી જાતીય સંબંધો રહ્યા છે.

બાઈડનનો ગુમચર એજન્સીઓને નિર્દેશ 3 માસમાં શૌધો ક્યાંથી ઉદભવ્યો કોરોના

અમેરિકાના રાષ્ટ્રીય પ્રયોગશાળાઓને સંશોધકોને મદદ કરવા નિર્દેશ આપવામાં આવ્યો

વોશિંગ્ટન

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને બુધવારે ગુમચર એજન્સીઓને કોવિડ-19 (કોરોના વાયરસ) મહામારીનું જન્મ સ્થાન શોધવા બમણો પ્રયત્ન કરવા નિર્દેશ આપ્યો હતો. બાઈડને એજન્સીઓને 90 દિવસની અંદર વાયરસનું જન્મ સ્થાન શોધીને રિપોર્ટ જમા કરાવવા કહ્યું હતું.

તેમણે જણાવ્યું કે, કોરોના વાયરસ કોઈ સંક્રમિત જાનવરના માનવીય સંપર્કથી ઉભર્યો છે કે કોઈ લેબ

દુર્ઘટનાએ આ મહામારીને જન્મ આપ્યો છે તે નિષ્કર્ષ શોધવાના સાક્ષીઓ અપૂરતા છે. તેમણે અમેરિકી રાષ્ટ્રીય પ્રયોગશાળાઓને સંશોધકોને મદદ કરવા નિર્દેશ આપ્યો હતો અને ચીનને આંતરરાષ્ટ્રીય તપાસમાં સહયોગ આપવા વિનંતી કરી હતી. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એ સિદ્ધાંતનો ફરી અભ્યાસ કરી શકે છે જેમાં કોરોના વાયરસનું ઉત્પત્તિ સ્થાન ચીનની વુહાન લેબ માનવામાં આવે છે અને ત્યાંથી જ તે સમગ્ર વિશ્વમાં ફેલાયો હતો.

આ બધા વચ્ચે અત્યાર સુધીમાં વિશ્વના 16.85 કરોડ લોકો સંક્રમિત થઈ ચુક્યા છે જ્યારે 35.01 લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. એક અહેવાલ પ્રમાણે ચીનમાં જ્યારે સૌથી પહેલી વખત આ બીમારી ફેલાઈ હતી ત્યારે કોરોના વાયરસ માટે જાનવરોની વ્યાપક તપાસ પર ચીનની ડેટાની અવગણના કરવામાં આવી હતી. કોરોના વાયરસની ઉત્પત્તિ મુદ્દે અમેરિકાએ ફરી એક વખત ચીન પર પારદર્શી તપાસનું દબાણ બનાવ્યું છે.

બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોન્સન આગામી વર્ષે ત્રીજા લગ્ન કરશે

લંડન

બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોન્સન આગામી વર્ષે ગરમીની સિઝનમાં પોતાની ફિયાન્સી કેરી સાયમંડ્રસ સાથે લગ્નના બંધનમાં બંધાઈ જશે. રિપોર્ટ પ્રમાણે જોન્સન અને સાયમંડ્રસ ૩૦ જુલાઈ ૨૦૨૨ના રોજ લગ્ન કરવાના છે. રિપોર્ટ પ્રમાણે બંનેએ પોતાના મિત્રો અને પરિવારના સભ્યોને લગ્નનું આમંત્રણ મોકલી દીધું છે. જોકે વેડિંગ ડેસ્ટિનેશનનો ખુલાસો કરવામાં આવ્યો નથી. બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોન્સન અને તેમની પ્રેમિકા કેરી સાયમંડ્રસે ફેબ્રુઆરી ૨૦૨૦માં સગાઈ કરી હતી. બંનેએ કહ્યું હતું કે તે ટૂંક સમયમાં લગ્ન કરશે. બોરિસ જોન્સનની ઉંમર ૫૬ વર્ષની છે.

સ્પેસએક્સ દ્વારા ૧૦૦મી સફળ અવકાશી સફર



સ્પેસએક્સ દ્વારા અવકાશમાં ૧૦૦મું સફળ લોન્ચિંગ કરી અવકાશી યાત્રામાં મહત્ત્વની સિદ્ધિ હાંસલ કરી હતી. કંપનીએ જણાવ્યું કે, તાજેતરની લોન્ચિંગમાં ફાલ્કન રોકેટ અને ૬૦ નવા સ્ટારલિન્ક સેટેલાઈટ અવકાશમાં મોકલાયા હતા. આ સાથે જ વાતાવરણમાં સ્ટારલિન્કના ઈન્ટરનેટ બિમિંગ સેટેલાઈટની સંખ્યા ૧,૦૩૭ થઈ ગઈ છે.

પીએનબી કૌભાંડમાં ભાગેડુ મેહુલ ચોકસીની ડોમિનિકાથી ધરપકડ થઈ

સેન્ટ જોહ્નસ

મધ્ય અમેરિકાના દેશ એન્ટીગુઆમાંથી ગાયબ થયેલ ભાગેડુ ભારતીય બિઝનેસમેન મેહુલ ચોકસી પડોસી દેશ ડોમિનિકામાંથી શોધી લેવાયો છે. ભાગેડુ મેહુલ ચોકસીને હવે એન્ટીગુઆ પરત લઈ જવાની તૈયારી કરવામાં આવી રહી છે. ભારતમાં પંજાબ નેશન બેંકના કૌભાંડના આરોપી અને ભાગેડુ મેહુલ ચોકસી વિરુદ્ધ ઈન્ટરપોલની રેડ કોર્નર નોટિસ જારી કરેલ છે. તેને ડોમિનિકાના ક્રિમિનલ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટએ ઝડપી લીધો હતો. એન્ટીગુઆથી તે ક્યુબા ભાગી ગયો હોવાના સમાચાર હતા. મેહુલ ચોકસી અને તેના ભત્રીજા નીરવ મોદી પર પીએનબી સાથે ૧૩,૫૦૦ કરોડનું કૌભાંડનો આરોપ હતો.

IPL 2021ની બાકીની મેચ UAEમાં રમાડવા BCCIનું આયોજન: 10 ઓક્ટોબરે ફાઈનલ

નવી દિલ્હી

ઈન્ડિયન પ્રીમિયર લીગના ચાહકો માટે સારા સમાચાર આવ્યા છે. અહેવાલો અનુસાર, આઈપીએલ 2021ની બાકીની મેચ યુએઈમાં યોજાશે. પહેલા એવા અહેવાલો હતા કે તેનું આયોજન ઈંગ્લેન્ડમાં થઈ શકે છે પરંતુ હવે આઈપીએલ 2021ની બાકીની મેચ યુએઈમાં રમાશે. સ્પોર્ટ્સ ટુએ દાવો કર્યો છે કે આઈપીએલ 2021ની શરૂઆત 19 અથવા 20 સપ્ટેમ્બરથી શરૂ થઈ શકે છે, જ્યારે ફાઈનલ મેચ 10 ઓક્ટોબરે



યુએઈમાં રમાશે. સ્પોર્ટ્સ ટુએ એવો પણ દાવો કર્યો છે કે બીસીસીઆઈ બીજી સીઝનમાં 10 ડબલ હેડર મેચ કરાવશે. મતલબ કે 10 દિવસ એવા હશે જ્યારે એક દિવસમાં બે મેચ યોજાશે. એવા અહેવાલો આવ્યા હતા

કે બીસીસીઆઈ અને ઈસીબી વચ્ચે ઈંગ્લેન્ડમાં યોજનારી ટેસ્ટ શ્રેણીના સમયપત્રકમાં ફેરફાર કરવાની ચર્ચા ચાલી રહી હતી. આ બધું આઈપીએલ 2021 માટે વિડો બનાવવા માટે કરવામાં આવી રહ્યું હતું, પરંતુ બંને બોર્ડ વચ્ચે કોઈ વાત શક્ય ન બની. આ પછી, બીસીસીઆઈએ આઈપીએલ 2021ની બાકીની મેચ યુએઈમાં યોજવાનું નક્કી કર્યું છે. કોરોના વાયરસને કારણે આઈપીએલ 2020ની છેલ્લી સીઝન પણ યુએઈમાં યોજાઈ હતી.

નાઓમી ઓસાકાએ
365 402
દિવસમાં કરોડની
કમાણી કરી




ન્યૂયોર્ક : અમેરિકાની સેરેના વિલિયમ્સને 20૧૮ના યૂએસ ઓપન ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટમાં હરાવીને ટાઇટલ જીતનાર જાપાનની નાઓમી ઓસાકાએ ટેનિસ જગતમાં સનસનાટી મચાવી હતી. ત્યાર પછી ચાર મહિનામાં ૧ ઓસાકાએ ઓસ્ટ્રેલિયન ઓપન પોતાના નામે કરી લીધો હતો. બે ગ્રાન્ડસ્લેમ જીતનાર તે જાપાનની પ્રથમ ખેલાડી બની ગઈ હતી. છેલ્લા ૧૨ મહિનામાં ઓસાકાએ વધુ બે ગ્રાન્ડસ્લેમ પોતાના નામે કર્યા હતા અને ન્યૂયોર્કના રસ્તાઓ ઉપર પોલીસ શૂટિંગમાં માર્યા ગયેલા સાત અશ્વેત લોકોના અધિકાર માટેના અભિયાનને બહેરમાં સમર્થન આપ્યું હતું. ઓસાકાની રમત તથા વ્યક્તિત્વથી પ્રભાવિત થઈને ઘણી કંપનીઓ તેની સાથે જોડાઈ છે. આ કારણથી ઓસાકાએ છેલ્લા ૧૨ મહિનામાં લગભગ ૫૫.૨ મિલિયન અમેરિકન ડોલર એટલે કે લગભગ ૪૦૨ કરોડ રૂપિયાની જંગી આવક કરી હતી. આ કોઈ પણ મહિલા એથલેટ્સની સરખામણીમાં હાઈએસ્ટ છે.

વિલારિયલે ૯૮ વર્ષમાં પ્રથમ વખત યુરોપા ફૂટબોલ લીગનું ટાઈટલ જીત્યું

ગડાંસ્ક (પોલેન્ડ): વિલારિયલે છેલ્લી મિનિટ સુધી અત્યંત રોમાંચક રહેલા પેનલ્ટી શૂટઆઉટમાં માન્ચેસ્ટર યુનાઈટેડને ૧૧-૧૦થી હરાવીને યુરોપા લીગ ફૂટબોલનું ટાઈટલ જીતી લીધું હતું. યુનાઈટેડનો ગોલકીપર ડેવિડ ડી જિયા પેનલ્ટી શૂટઆઉટમાં શાનદાર દેખાવ કરી શક્યો નહોતો અને તે વિલારિયલના કોઈ પણ ખેલાડીનો શોટ રોકી શક્યો નહોતો. છેલ્લે તે ગોલ કરવામાં પણ નિષ્ફળ રહ્યો હતો. બંને ટીમો નિર્ધારિત સમય બાદ એક્સ્ટ્રા ટાઈમમાં પણ ૧-૧થી સરભર રહી હતી. ત્યારબાદ પેનલ્ટી શૂટઆઉટનો સહારો લેવામાં આવ્યો હતો. છેલ્લે બંને ટીમના ગોલકીપરને પેનલ્ટી માટે ગોલબોક્સ છોડવાની ફરજ પડી હતી.

શિવ થાપાએ રેકોર્ડ સર્જ્યો, એશિયન ચેમ્પિ.માં સતત પાંચમો મેડલ જીત્યો

દુબઈ : ભારતીય બોક્સર શિવ થાપાએ એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં સતત પાંચમો મેડલ જીતીને નવો ઇતિહાસ સર્જ્યો હતો. થાપાને પાંચમો મેડલ સુનિશ્ચિત કર્યા બાદ તેણે કોરોના વાઈરસ સામે વિજય હાંસલ કર્યો હોય તેવી લાગણી થઈ હતી. ૨૭ વર્ષીય બોક્સરે દુબઈમાં રમાતી ચેમ્પિયનશિપની સેમિફાઈનલમાં પ્રવેશ કરીને પોતાનો મેડલ નિશ્ચિત કર્યો હતો. શિવ થાપા ટૂર્નામેન્ટમાં ભારતનો સૌથી સફળ બોક્સર બની ગયો છે. તેણે ૨૦૧૩ની એશિયન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.



ડોક્ટર્સની ચેતવણી, ગેમ્સ યોજાશે તો કોરોનાનો નવો ઓલિમ્પિક સ્ટ્રેન ફેલાશે

ટોક્યો: જાપાનમાં આગામી ૨૩મી જુલાઈથી આઈમી ઓગસ્ટ સુધી ઓલિમ્પિક યોજાવાની છે. એક તરફ જાપાન સરકાર તથા ઈન્ટરનેશનલ ઓલિમ્પિક સમિતિ ગેમ્સનું આયોજન કરવા માટે કટિબદ્ધ છે તો બીજી તરફ દેશના મોટાભાગના લોકો ગેમ્સનાં આયોજનને રદ કરવાની માગણી કરી રહ્યા છે. આ તમામની વચ્ચે જાપાનના એક ડોક્ટર્સ યુનિયને ઓલિમ્પિક અંગે મોટી ચેતવણી આપી છે. યુનિયનના પ્રમુખ નાઓતો ઉયામાએ જણાવ્યું હતું કે ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે વિશ્વભરના એથલેટ્સ જાપાન આવશે અને આ સ્થિતિમાં કોરોનાનો નવો ઓલિમ્પિક સ્ટ્રેન ફેલાવાનું મોટું જોખમ છે.

રિયલ મેડ્રિડ ૧૧ વર્ષમાં પ્રથમ વખત ટાઈટલથી વંચિત, જિદાનનું રાજીનામું

મેડ્રિડ : જિનેટિન જિદાને વધુ એક વખત રિયલ મેડ્રિડના કોચપદથી રાજીનામું આપી દીધું છે. ચાર દિવસ પહેલાં સમાપ્ત થયેલી સિઝનમાં મેડ્રિડની ટીમ એક દશકા કરતાં વધારે સમયમાં પ્રથમ વખત કોઈ પણ ટાઈટલ જીતી શકી નથી. ફાન્સના વર્લ્ડ કપ વિજેતા ટીમના ભૂતપૂર્વ સુકાની જિદાનનો રિયલ મેડ્રિડ સાથેનો કરાર ૨૦૨૨ના જૂન સુધીનો હતો, પરંતુ તેણે પોતાનું કોચપદ છોડી દીધું છે. રિયલ મેડ્રિડ ક્લબે જણાવ્યું હતું કે જિદાને મેડ્રિડના કોચ તરીકેના કાર્યકાળને પૂરો કરવાનો નિર્ણય કર્યો છે.



HONEST - DEDICATED - TEAMWORK

Don't Let Confusion Cast A Shadow over Buying Your Dream Home.

We Look forward to providing you with an unusually High Level of Service and Commitment giving you a New definition of results in the Real Estate Industry. After all it is your Satisfaction that defines our Success!!!

JUST LISTED Markham/Ellesmere
\$399,000

Stunning Condo With Extra Ordinary Features With Private Dining Room, Private Theater, Party Room, Outdoor Pool, & Tanning Area. Best Location, Minutes To Hwy 40, Scarborough Town Centre, Centennial College, University Of Toronto, Banks, Convenience Stores Etc... Ideal For Investors And 1st Time Buyers Could Be Purchased With 5% Down Payment. Don't Miss The Opportunity To Buy And Rent Or Live Next To U Of T (Scarborough) / Centennial College.

JUST LISTED Morningside And Staines
\$799,000

Mattamy Built Semi Detached Home In Rouge Community. Beautiful 3 Bedrooms + 4 Washrooms. Hardwood Floor In Main And 2nd Floor, With Oak Stairs. Modern Kitchen With Quartz Counter Top And S/S Appliances, Open Concept. Step To Brookside School. 24 Hours Tlc, Mall Plaza, Highways And Places Of Worship. Extras: S/S Fridge, S/S Stove, S/S Dishwasher And S/S Washer/Dryer, 2 Gd Openers And Elf And A/C Unit. California Shutters. Must Certified Deposit Cheque. Attached Schedule B And Form 801 With All The Offers. Custom Built W/In Closet In Master Bdrm

JUST LISTED Ashburn/Vipond/ Darius Harns (Whitby)
\$799,000

This Gorgeous North Whitby Family Home Nestled In A Highly Sought After Brooklin Community! Located On A Quiet Street. Finished Top To Bottom Move In. Steps To Public And Catholic Schools, Parks And Amenities. Close To Hwy 407/412 To 401. Steps To Public And Catholic Schools, Parks And Amenities. Transit. Garage Entry Form Inside The Home, Walkout To Fully Fenced Good Size Backyard. Finished Basement.

NEED MORE LISTINGS, CALL US FOR SPECIAL DEALS

CALL US FOR FURTHER INFORMATION OR TO BOOK A SHOWING TO VIEW PROPERTIES.

Use The Advantage of a Team, Because...Teamwork Makes Your Dreams Work !

અમારી મફત સલાહનો લાભ ઉઠાવવા માટે આજે જ સંપર્ક કરો

Shamim & Amin Kharodia
Sales Representatives
info@kharodiarealestate.com
647.501.6786 SHAMIM | 647.308.2941 AMIN

Century 21 BRAND POWER & INNOVATIVE TECHNOLOGIES TO GET YOUR HOME RECOGNIZED!
2250 MARKHAM ROAD, UNIT 3 TORONTO, ON, M1B 1W3
OFFICE : 416 298 8383 FAX : 416 298 8303

19th Stakeholder of All S&P International Trading & V. Bond under license by Century 21 Inc. and Century 21 Canada Limited Partnership

MASTERS RUBY

Grand Century Office

Each office owned and Operated. This is not intended to solicit buyers/sellers currently under contract with any brokerage.



CLUB CERAMIC



Lapoto Finish

પોર્સેલિન
ટાઈલ્સ શરૂ થાય
છે ફક્ત
\$ 0.89 થીPorcelain tiles starting from
\$0.89 per square
feet only

- ◆ Porcelain & Ceramic tiles at Direct factory price
- ◆ Price match guarantee + we will beat price with additional 5% discount
- ◆ Tiles available for Floor, Wall and Outdoor Parking



Matt Fiish

Ceramic tiles starting from
\$0.50 per square
feet onlyસિરામિક
ટાઈલ્સ શરૂ
થાય છે
\$ 0.50 થી

- ◆ પોર્સેલિન ટાઈલ્સ અને સિરામિક ટાઈલ્સ ફેક્ટરી ભાવે મળશે
- ◆ અમારા ભાવની ખાત્રી કરી શકો છો. વધારાના ૫ ટકા ડિસ્કાઉન્ટ સાથે
- ◆ ફ્લોર, દિવાલ અને આઉટડોર પાર્કિંગની ટાઈલ્સ મળશે

-: Available Size :-

24" * 24" | 12" * 24" | 24" * 48" | 4" * 8" | 4" * 12"

MONTREAL3590, Rue Griffith, Saint Laurent, QC, H4T 1A7
Phone: +1-514-260-2242 /
+1-514-813-3850**OTTAWA**Unit #4+5, 200 Colonnade Road,
Nepean, ON, K2E 7M1
+1-613-601-1474**MISSISSUAGA**5030 Maingate Drive, Unit#1, Mississauga, L4W 1X5
Phone: +1 (647) 527-6030 /
+1-514-813-3850<https://clubceramic.com> Email : sales@clubceramic.com

**Chapel
Ridge**

FUNERAL HOME
& CREMATION CENTRE

416.993.0826
24/7 # 905.305.8508



તમારી સગવડ માટે અમે બે ફ્યુનરલ સેન્ટર ઓફર કરીએ છીએ. મારખમ અને મિસિસાગા. સંપૂર્ણ હિન્દુ તથા જૈન વિધિની સગવડતા. (St. John's Dixie, 737 Dundas St. E., Mississauga, ON L4Y 2B5)

ફ્યુનરલ સર્વિસ, બેઝિક કાસ્કેટ, ક્રિમેશન અને ટેક્સ બધાં સાથે ટોટલ ફક્ત \$4270

વધુ માહિતી માટે ફોન કરો. અમારો પ્રોફેશનલ સ્ટાફ તમારી ભાષામાં તમને માહિતી આપશે.
પ્રિપેઇડ ફ્યુનરલ અને ટ્રાવેલ ઈન્સુરન્સ

1. તમારા ડોલર ફ્યુનરલ હોમમાં જમા નહિ થાય. પરંતુ સરકારે નીમેલી ટ્રસ્ટ કંપની પાસે રહેશે.
2. એક વખત પ્લાન ખરીદ્યા પછી તમે કે તમારા ફેમિલીએ કદીપણ વધુ પૈસા નહિ આપવા પડે.
3. ટ્રાવેલ ઈન્સુરન્સ - ફક્ત **\$595** એક વખત આપી જિંદગી ભર તમે ક્યાંય પણ નિશ્ચિત ટ્રાવેલ કરી શકશો. *

* This is not a general insurance. Applies only in case of a death away from home.

8911 Woodbine Avenue, Markham, Ontario L3R 5G1
www.chapelridgefh.com • info@chapelridgefh.com